

PATIDAR BUILDCON LTD.

Regd. Off.: Lati Bazar, Joravarnagar - 363 020 Dist. Surendranagar (Gujarat) E-mail : patidarbuildconltd@rocketmail.com CIN No.: L99999GJ1989PTC058691

Ref. No.:

Date :

Date:10/11/2020

To, Gen. Manager (DCS) BSE Limited. P J Towers, Dalal Street, Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 524031

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the Quarter and half year ended on 30th September, 2020 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 09th November, 2020.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,


FOR, PATIDAR BUILDCON LIMITED

MR. RAJNIKANT PATEL MANAGING DIRECTOR (DIN: 01218436)

22

FINANCIAL EXPRESS

2	(CIN: L65110GJ1993PLC020769) Corporate Office, Axis House, Structured Assets Group, C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400025. Tel: +91 22 24255719 www.axisbank.com	
1	POSSESSION NOTICE (For Immoveable Property) As per Appendix IV read with rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002	
Se 20 20 20 Th Ni Ka Mi Hu da	Thereas, the undersigned being the Authorised Officer of Axis Bank Ltd., under the ecuritisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 002 (54 of 2002) (hereinafter referred to as "SARFAESI Act") and in exercise of powers onferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 002 issued a demand notice dated 12.11.2019 calling upon the Borrower viz. Jay Shree hreads Pvt. Ltd and its Guarantors and/or Mortgagors i.e. Mr. Vikas D Gheewala, Mrs. ilisha V Gheewala, Ms. Dipali P Sopariwala, Mr. Pravinchandra Venilal Sopariwala, Mr. ailash P. Rajdev, Mrs. Krishna K. Rajdev & Shubh Shree Industries to repay the amount entioned in the notice being Rs.2,00,40,377.85 (Rupee Two Crore Fourty Thousand Three undred Seventy Seven and Eight Five paisa only) being the amount due as on 10.11.2019 plus rther interest at the contractual rate thereon till the date of payment; within 60 days from the ate of receipt of the said Notice.	
giv sy un	he Borrower, Guarantors & Mortgagors having failed to repay the said amount, notice is hereby ven to the Borrower & Guarantors and the public in general that the undersigned has taken imbolic possession of property described herein below in exercise of powers conferred on him nder sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest. Inforcement) Rules, 2002 on this 05.11.2020.	
ge pr (R or	he Borrower, Guarantors & Mortgagors mentioned herein above in particular and the public in eneral are hereby cautioned not to deal with the subject property and any dealings with the said roperty will be subject to the charge of Axis Bank Ltd. for an amount of Rs.2,00,40,377.85 Rupee Two Crore Fourty Thousand Three Hundred Seventy Seven and Eight Five paisa nly) being the amount due as on 10.11.2019 with further interest thereon at contractual rates gether with costs, charges, other monies until payment or realization in full.	
	he Borrower's, Guarantor's and Mortgagor's attention is invited to provision of sub-section (8) section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.	
1.	DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES Property bearing Flat No.9/B of "Golden Avenue Apartment" unit of "Golden Avenue Co- operative Housing Society Limited" constructed on land bearing Revenue Survey No. 70/4, T P No. 4, (Umra South) . Final plot No. 82, paiki sub plot A/1/1, A/1/2, A/1/3 and A/2 Situated moje Village Umra Dist. Surat standing in the name of Mr. Kailesh Pranlal Rajdev and Mrs. Krishna Kailesh Rajdev.	
2.	Flat Type Awas No. 403, admeasuring 69.81 Sq. Meters build up area of the said flat along with the undivided proportionate share in the land with all the right of Dhyan Yog Apartment constructed on non-agricultural land bearing Revenue survey No. 251/A, TP Seheme No. 05, final plot no. 126, City Survey Nondh no 2050 situated at moje village Athwa, sub Dist Choryasi Dist Surat standing in the name of Shri Pravinchandra Venial Supariwala.	-
3.	All that right title and interest in the Flat no. 102 admeasuring about 1,475 sq.fts. i.e. 134 sq. mts. on the 1st floor of "D" Building of the Chandanpark Apartment situated on the land bearing Revenue Survey No. 150/A of village Umra, Taluka City District Surat and Final Plot No.92 paiki of Town Planning Scheme No.4 (Umra-South) is of the absolute ownership of Mr. Vikas Dilipkumar Gheewala & Mrs. Nilisha Vikas Gheewala. The Flat is bounded as below: North: Road of Society; South: Adj. Flat No. 101; East: Adj. Flat No.	BAJAJ FINSERV Branch Office
	103 and West: Road of Society Sd/-	U/s 13(4) of the Secu Act 2002. Rule 8-(1) o
	ate:05.11.2020 Authorised Officer ace:Surat Axis Bank Ltd.	Whereas, the unders
	AXIS BANK LIMITED (CIN: L65110GJ1993PLC020769) Corporate Office, Axis House, Structured Assets Group, C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400025. Tel: +91 22 24255719 www.axisbank.com POSSESSION NOTICE (FOT Immoveable Property) As per Appendix IV read with rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002	Securitization and Rec powers conferred und Demand Notice(s) to mentioned in the notic Guarantor(s) having Guarantor(s) and the p possession of the prop the said Act read with
1.0		aublic in general are b



POSSESSION NOTICE

Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (1) of the Security Interest (Enforcement) Rules 2002. (Appendix-IV)

ndersigned being the Authorized Officer of M/s BAJAJ FINANCE LIMITED (BFL) under the Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued s) to Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) mentioned herein below to repay the amount notice within 60 days from the date of receipt of the said notice. The Borrower(s) /Co Borrower(s)/ ving failed to repay the amount, notice is hereby given to the Borrower(s) /Co Borrower(s)/ the public in general that the undersigned on behalf of M/s Bajaj Finance Limited, has taken over the property described herein below in exercise of the powers conferred on him under Section 13(4) of with Rule 8-(1) of the said rules. The Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) in particular and the Whereas, the undersigned being the Authorised Officer of Axis Bank Ltd., under the public in general are hereby cautioned not to deal with the below said property and any dealings with the said property

			-	-
- 8	ın	ты	C I	
- 8	10		ا هـ ا	

Notice is hereby given that the Share Certificates issued by Hester Biosciences Limited standing in the names of below mentioned shareholders have been reported lost/ misplaced and that an applications for issue of duplicate certificate in respect thereof has made to the Company at 1st Floor, Pushpak, Panchavati Circle, Motilal Hirabhai Road, Ahmedabad 380006.

Folio No.	Name of Share holder	Distinctive No.	Certificate No.	No. of Shares
000410	1. Anand Niranjan Modi	2235301 · 2235400	11752	100
	2. Mitesh Deepak Shah	8376079 - 8376128	26388	50 150
002847	Jaiprakash Solanki	2605001 · 265100 8390089 · 8390138	15449 26641	100 50 150

Any person having claims / objections in respect of the said Shares, should communicate to the Company at the Registered Office or to the Registrar and Share Transfer Agent at the address given below within 15 (Fifteen) days from the date of this advertisement, else the Company will proceed to issue duplicate certificate after expiry of 15 (Fifteen) days. Registrar and Share Transfer Agent: Link Intime India Private Limited 5th Floor, 506 to 508, Amarnath Business Centre - I (ABC-I), Beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off. C. G. Road, Elliesebridge, Ahmedabad 380006 Place: Ahmedabad Date: 09.11.2020

	EXTRACT FROM THE STANDALONE THE QUARTER AND HALF	YEAR ENDED	ON 30.09.202	0 Rs. in Lacs
Sr. No.	Particulars	Quarter ended on 30th September, 2020	For the half year ended on 30th September 2020	Corresponding 3 Months Ended on 30th September, 201
1	Total income from operations Net Profit / (Loss) for the period (before Tax,	48.67	90.43	11.64
3	Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax	(3.58)	28.83	(9.12)
4	(after Exceptional and/or Extraordinary items)	(3.58)	28.83	(9.12)
4 5	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after	(3.57)	28.85	(9.12)
6 7	tax) & other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	(3.57) 550.05	28.85 550.05	(9.12) 550.05
8	of Previous Year Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	079794-6-001	141.21	110.21
	Basic : Diluted :	(0.06) (0.06)	0.52	(0.17) (0.17)
PI		d on 9th November, 2	2020. R OF THE BOARD FOR, PATIDAR	OF DIRECTORS
Da	ate : 09-11-2020			(DIN-01218436)
	The Indian Dank	L OFFICE SURA /Est field squ	ARE, SURAT-39	95007
िंद	G ALLAHABAD		• • • • • • • • • • • • • • • • • • • •	

ecuritisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) (hereinafter referred to as "SARFAESI Act") and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 12.11.2019 calling upon the Borrower viz. Shubh Shree Industries and its Guarantors and/or Mortgagors i.e. Mr. Vikas D Gheewala, Mrs. Nilisha V Gheewala, Ms. Dipali P Sopariwala & Ms. Nalini P Sopariwala to repay the amount mentioned in the notice being Rs.8,39,75,387.00 (Rupee Eight Crore Thirty Nine Lakh Seventy Five Thousand Three Hundred Eighty Seven only) being the amount due as on 10.11.2019 plus further interest at the contractual rate thereon till the date of payment; within 60 days from the date of receipt of the said Notice.

The Borrower, Guarantors and Mortgagors having failed to repay the said amount, notice is hereby given to the Borrower & Guarantors and the public in general that the undersigned has taken symbolic possession of property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 05.11.2020.

The Borrower, Guarantors and Mortgagors mentioned herein above in particular and the public in general are hereby cautioned not to deal with the subject property and any dealings with the said property will be subject to the charge of Axis Bank Ltd. for an amount of Rs.8,39,75,387.00 (Rupee Eight Crore Thirty Nine Lakh Seventy Five Thousand Three Hundred Eighty Seven only) being the amount due as on 10.11.2019 with further interest thereon at contractual rates together with costs, charges, other monies until payment or realization in full.

The Borrower's, Guarantor's and Mortgagor's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES

 All that piece and parcels of the land bearing Plot No. I6/A admeasuring about 1,321 sq. mtrs. of Pipodara Industrial Estate situated on the land bearing Revenue Survey No. 67 i.e. Block No. 58 of village Pipodara Taluka Mangrol District Surat is of the co-ownership of Mrs. Nilisha Vikas Gheewala & Mrs. Dipali Pravinchandra Sopariwala. The land is bounded as below: On the East by: Open Land On the West by: Plot no. 16-B of Block. No. 58 On the North by: Land bearing Block. No. 59 On the South by: Land bearing Block. No. 58 All that piece and parcels of the land bearing Plot No. I6/B admeasuring about 3,316 sq. mtrs. of Pipodara Industrial Estate (Presently known as Ekta Industrila Estate) situated on the land bearing Revenue Survey No. 67 i.e. Block No. 58 of village Pipodara Taluka

No, Name of Branch)	Description of Secured Asset (Immovable Property)	Date and Amount	Date of Possession
nch: Surat I: (4280HL00092194, 4280HL00019942 and DHL17677521) rower's: / Co – borrower's ALAZONE SILK MILLS (Borrower) RYING BUSINESS AT: -PLOT 44-45 GR+1ST SOMA KANJI NI WADI KHATODARA SURAT 210 ISHWAS SATISH ARORA (Co-Borrower) RPIT SATISH ARORA (Co-Borrower) AVITA V ARORA (Co- Borrower) AMEETA S ARORA (Co- Borrower) AMEETA S ARORA (Co- Borrower) ABOVE STAYING AT: -B 501 PRATHAM APP ITY LIGHT NR NAVPAD APPT SURAT 395007	BUILDING NEAR NAVPAD APPARTMENT, R.S NO- 7012, EP NO:65, TPS NO-4, UPMA SOUTH CITY ROAD SURAT, 395007. North:- OTS & PLOT NO. 501	2020 Rs.1,23,07,252/ - (Rupees One Crore Twenty Three Lac Seven Thousand Two Hundred Fifty	06TH November 2020
1. 2 M TH 2	[1] Z. CE, PR. S. C. MARKETER, D. CHR. ER. 1987, Mar.	- <i>OTS</i> F	




Sr. No.	Name of Borrower / Co-Borrower/ Guarantor	Description of Mortgaged Property	Property Possession Date	Total Outstanding Amount	Reserve Price (Rs.)	E.M.D. (Rs.)	SALE DATE
4	Sagarkumar Shivlal Sojitra Shivabhai Jinabhai Sojitra Lan No :- 16100073259	Block No 430 P Flat No 301, R S No 460 1 471 Building No A 3rd Floor, janvi Residency, canal Road, moje Kamrej, Gujarat, Surat, 395010, India	13-02-2020	Rs. 1270876.66/- AS ON DATE 13-08-2019	750000/-	75000/-	23-11-20
2	Sanjit Balbahadur Soni Bhupat Ghevariya Lan No :- 16100010518	Block No 3 To 10 12 19 362, Of Aaradhana Lake Town,vivhag 2,plot No 221,b/s Bal Krishna Row House, Halpatiwas Jolwa, Surat, Gujarat, Palsana	03-01-2020	Rs. 748631.69/- AS ON DATE 22-03-2019	750000/-	75000/-	23-11-20
3	Mukeshbhai Harjivanbhai Harsora Bhavnaben Mukeshbhai Harsora Lan No :- 16100076829	19 /a,390, Krishna Park, Kamrej, Kamrej, Gujarat, Surat, 394185, India	13-02-2020	Rs. 1056855.85/- AS ON DATE 13-08-2019	1000000/-	100000/-	08-12-20
4	Ulhas Kishan Khaimar Savita Ulhas Khaimar Lan No :- 16100077037	358, Sai Vatika Row House, Opp. Sarvottam Hotel, Kadodara Bardoli Road, Surat, Gujarat, Surat, 394315, India	19-06-2020	Rs. 1373027.43/- AS ON DATE 22-03-2019	950000/-	95000/-	23-11-20

and the public in general that the undersigned has taken **Symbolic Pussess** described herein bellow in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act (read with rule 8, 9) of the said rules on this herein below mentioned date.

The borrowers and guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the Indian Bank for an amount of mentioned in the notice and further interest thereon.

The borrowers' attention is invited to provision of section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secure assets.

Mangrol District Surat is of the co-ownership of Mrs. Nilisha Vikas Gheewala & Mrs. Dipali Pravinchandra Sopariwala. The land is bounded as below: On the East by: Plot no. 16-A of Block. No. 58 On the West by: Estate Road On the North by: Land bearing Block. No. 59 On the South by: Land bearing Block. No. 58 Std/-	PUBLIC NOTICE – AUCTION CUM SALE OF PROPERTY Sale Of Immovable Assets Under Securitization And Reconstruction Of Financial Assets & Enforcement Of Security Interest Act, 2002 In exercise of powers contained in the Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002, the No	1.Bharuch (1) Mr. Hitesh E-AlbAll that piece & parcel of the immovable freehold Residential Plot No. 7, adm. Area 13,12,296/-Rs. 10-02-202005.11.2 05.11.2 Symbol
Date:05.11.2020 Authorised Officer Place:Surat Axis Bank Ltd.	Sr. Name of Borrower / Co-Borrower/ Guarantor Description of Mortgaged Property Property Date Total Amount Reserve Price (Rs.) E.M.D. (Rs.) SALE DATE	(2) Mr. Sunilbhai Bhikhubhai Solanki (Guarantor) Schem known as "Sahyog Residency" lying on Revenue Survey No. 438 paiki, Village- Kosamadi, Taluka- Ankleshwar, District- Bharuch, Gujarat, standing in the name of Mr.
KOTAK MAHINDRA BANK LTD. Corporate Identity No. : L65110MH1985PLC038137 Registered Office :27 BKC, C 27, G Block, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 051 Branch Office : Kotak Mahindra Bank Ltd 2nd Floor, Shrinath Complex , opp. Jia Panchayat office Rajkot Gujrat 360102 PHYSICAL POSSESSION NOTICE	Sagarkumar Shivlal Sojitra Block No 430 P Flat No 301, R S No 460 1 471 Rs. 1270876.66/- AS ON DATE 75000/- 75000/- 1 Shivabhai Jinabhai Sojitra Lan No :- 16100073259 Building No A 3rd Floor,janvi Residency,canal Road,moje Kamrej, Gujarat, Surat,395010, India 13-02-2020 Rs. 1270876.66/- AS ON DATE 750000/- 75000/- 23-11-20	Hitesh Mohanbhai Harijan. Boundaries:- North: Lagu Plot No8, South: Lagu Plot No. 6 East: Lagu Society's Road, West: Lagu Block/Survey No's Land.
(For immovable property) (As per Appendix IV read with Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002) WHEREAS, The undersigned being the Authorized Officer of KOTAK MAHINDRA BANK	Sanjit Balbahadur Soni Block No 3 To 10 12 19 362, Of Aaradhana Lake Rs. 748631.69/- 75000/- 75000/- 23-11-20 2 2 Bhupat Ghevariya Town,vivhag 2,plot No 221,b/s Bal Krishna Row 03-01-2020 AS ON DATE 75000/- 75000/- 23-11-20 2 2 2 2 2 3-01-2020 AS ON DATE 2 2 3-01-2020 AS ON DATE 2 3-01-2020 2 3-01-2020 2 3-01-2020<	2. Ankhleshwa K/s Pramod M Pathak Co. E-Alb (Proprietorship Firm, Borrower) All that piece & parcel of the immovable Rs. freehold Residential Plot No. B/15, adm. Area 71.00 sq. Mtrs. & construction thereon in the schem known as "Sailok Tenament" lying on
LIMITED, a banking company within the meaning of the Banking Regulation Act, 1949 having it's Registered Office at 27BKC, C 27, G Block, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 051 and Reginal office at Kotak Mahindra Bank Ltd2 nd floor, Shrinath complex, opposite jila panchayat office Rajkot Gujrat 360002 under the Securitization and Reconstruction of Financial	3 Mukeshbhai Harjivanbhai Harsora 19 /a,390, Krishna Park, Kamrej, Kamrej, Rs. 1056855.85/- 1000000/- 1000000/- 1000000/- 08-12-20 3 Bhavnaben Mukeshbhai Harsora Gujarat, Surat, 394185, India 13-02-2020 Rs. 1056855.85/- 1000000/- 1000000/- 08-12-20 1 Uhas Kishan Khaimar 358, Sai Vatika Row House, Opp. Sarvottam Rs. 1373027 43/- Rs. 1373027 43/-	1.Mrs. Anjali Pramod Pathak (Proprietor & Bharuch, Gujarat, standing in the name of Mrs.
Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The Details of the Parties along with Mortgaged Property over physical	4 Ulhas Kishan Khaimar Savita Uhas Khaimar Lan No :> 16100077037 358, Sai Vatika Row House, Opp. Sarvottam Hotel, Kadodara Bardoli Road, Surat, Gujarat, Surat, 394315, India 19-06-2020 Rs. 1373027.43/- AS ON DATE 22-03-2019 95000/- 95000/- 95000/- 23-11-20 Inspection Date & Time : 17-11-2020 (For LAN 16100073259, 16100010518 and 16100077037) at 10.00 AM to 05.00 PM	Anjali Pramod Pathak. Boundaries:- North: 2.Mr. Pramod M Adj. Open Land, South: Adj. Plot No. B/16. Pathak (Guarantor) East: Adj. Plot No. B/14, West: Adj. Internal Road.
Date of Demand (Borrower(s)/ Co-Borrower(s) and Guarantor(s) along Loan Account Nos Date of Demand Notice u's 13(2) read with rule 9 of SARFAESI Act. Along with Amount in Rs. Description of Immovable Property taken in to Possession (As per Appendix IV read with Rule 8 (1) of theSecurity Interest (Enforcement) Rules, 2002) Loan Account No.A/c IHL35506 Demand Notice Dated (Borrower) SUB PLOT NO. 104/2/105/106/4 TO 6/3, SHREE Demand Notice Dated 21/11/2017 Allthat part and parcel of Mortgaged Property which is situated atPlot Immovable Property Situated At Sub Plot No. No. 104/2/105/106/4+ DADI RIVER PULL, R.S. NO. 246/3/P/1/P, RAJKOT-360002 N in e t y E i g h t Thous and Three Hundred Forty Nine and Sixty One Paisa 0 n I y) a s 0 n No. 246/3/P/ 1/P, Rajkot-360002, Together With Construction Thereon Which Is	21-11-2020 & 23-11-2020 (For LAN No. 16100076829) at 10.00 AM to 05.00 PM, Muthoot Housing Finance Co. Ltd., 2-653/2-3, Mota Dastur Mohallo, Behind kotak Mahindra bank, Rushtampura, Udhana Darwaja, Surat-395002. Amrendra Singh – 9537621311 Intending bidders may inspect the properties on the date and time as mentioned above. Terms & Conditions of public auction:- 1) Sale is strictly subject to the terms and conditions mentioned hereunder as also the terms and condition mentioned in the offer/ tender document to be submitted by the intending bidders. 2) The property will be sold on "As is where is" and "As is what is" "whatever there is" and "no recourse" condition, including encumbrances, if any. 3) The properties under auction can be inspected on the date & time specified above. For any queries with regards to inspection of properties or submission of tenders, kindly establish contact to The Authonised Officers at respective locations on above mention contact numbers. The interested buyers may send theirs offers for the above property in a sealed cover along with Demand Draft Payable at Mumbai favoring "Muthoot Housing Finance Company Limited", towards earnest money deposit (EMD) 10% of Reserve Price at the above mentioned office address of The Authonised Officer on one working day before the date of Auction. 4) Offers that are not duly filled up or offers not accompanied by the EMD or Offers received after the above date and time prescribed herein will not be considered / treated as invalid offers, and accordingly shall be rejected. The Earnest money deposit shall not carry any interest. 5) Along with offer documents, the intending bidder shall also attach a copy of the PAN card issued by the income Tax department AND bidder's identity proof and the proof of residence such as copy of the Passport. Election Commission Card, Ration Card, Driving license etc. 6) In no eventuality the property would be sold below the reserve price. 7) The bidders present in the auction would be allowed to increase their offer mult	3. Sachin M/s Rudra Puja Impex 1. Mr. Mukeshbhai Laljibhai Paladiya, (Proprietor & Borrower), 2. Mrs. Sangitaben Mukeshbhai Paladiya (Guarantor & Mortgagor Property No1: All that piece or parcel of immovable property known as bearing Plot No. 81 admeasuring about 188.88 Sq. yard equivalent to 157.91 Sq.mtrs together with common rights in road admeasuring about 211.93 Sq. mtrs of "H" type at Gayatri Industria situated on the land bearing new Block No.516 [Old Block No 475] [Revenue Survey No. 479] Block no:475, Revenue survey No:504, Block No:501] of Village- Pipodara Ta: Mangrol, Dist- Surat stands in the name of Sangitaber Mukeshbhai Paldiya. Bock No 489, EAST Society Common road, SOUTH : PLOT NO 82. 03-12-2019 05.11.2 Property No2: All that piece or parcel of Rs. 03-12-2019 05.11.2
HARIOM PARK 2, Nr. KHOKHAD DADI RIVER PULL, R.S. NO. 246/3/P/1/P,RAJKOT-360002 3. Mr. JERAM RATHO (Co- Borrower) SUB PLOT NO. 104/2/105/106/4 TO 6/3, SHREE HARIOM PARK 2, Nr. KHOKHAD DADI RIVER PULL, R.S. NO. 246/3/P/1/P,RAJKOT-360002 The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the	4. 4. A construction of the Sale Certificate in respect of the said properties shall be paid by the successful bidder/purchaser. 10) The successful bidder/purchaser shall have to pay 25% of the purchase amount (after adjusting the E.M.D. already paid) within 2 working days from the acceptance of the offer by the Authorized Officer in respect of the sale, failing which, the earnest money deposit will be forfielded. 11) The balance 75% of the Sale price shall have to be paid within 30 days of conveying the confirmation of the sale to the successful Purchaser by the Authorized Officer or such extended period as agreed upon in writing by and solely at the discretion of the Authorized officer. In the event of the default in payment of the balance 75% of the sale price or any part thereof, within the prescribed period, the amount deposited shall be forfielded and the secured creditor will be at liberty to sell the property once again and the defaulting Purchaser shall forfielt all claims to the property or to any part of the sum already paid towards the purchase thereof. 12) The Demand draft / Pay order deposited towards the Earnest money shall be returned to unsuccessful bidders. 13) The immovable property described herein above shall remain and be at the sole risk of the successful purchaser in all respects including loss or damage by fire or theft or other accidents, and other risk from the date of the confirmation of the Sale by the undersigned Authorized Officer. The successful bidder shall not be entitled to annul the sale on any ground of whatsoever nature. 14) The Authorized officer is not bound to accept the highest offer or any or all	4. Sachin M/s Yatri Fab 1. Mrs. Sangitaben Mukeshbhai Paladiya, (Proprietor,Borrower & Mortgagor), 2. Mr. Mukeshbhai Laljibhai Paladiya (Guarantor) M/s Yatri Fab 1. Mrs. Sangitaben Mukeshbhai Paladiya, (Proprietor,Borrower & Mortgagor), 2. Mr. Mukeshbhai Laljibhai Paladiya (Guarantor) M/s Yatri Fab 1. Mrs. Sangitaben Mukeshbhai Paladiya, (Bitti Common rights in road admeasuring about 54.02 sq.mtrs total admeasuring about 211.93Sq.mtrs of "H" type at Gayatri Industria situated on the land bearing new Block No.516 [Old Block No 475] [Revenue Survey No. 504, Block No:501] of Village - Pipodara Ta: Mangrol, Dist- Surat stands in the name of Sangitaber
public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act read with Rule 9 of the said rules on the date as mentioned above in "Date of Possession" Colum. The Borrowers mentioned herein above in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to charge of KOTAK MAHINDRA BANK LIMITED, for an amount as mention in this notice, along with future interest at contractual rate and substitute interest, incidental expenses, costs and charges etc. due w.e.f. the very next date of the status of outstanding amount date showing in the above mention details, till the date of full repayment and/ or realization. Further the borrower's attention invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured	offers and M/s Muthoot Housing Finance Company Ltd., as secured creditor, reserves its right to reject any or all bid(s) without assigning any reasons. In case, the bids are rejected, Authorized officer can negotiate with any of the tenderer or intending bidders or other parties for sale of the property by private treaty. 15) No persons other than the intending bidders/offerer themselves, or their duly Authorized representative shall be allowed to participate in the auction/sale proceedings. 16) The Authorized officer reserves his right to vary any of the terms and condition of this notice for sale, without prior notice, at his discretion. 17) In case, all the dues together with all cost, charges and expenses incurred by the Secured Creditor are tendered by the above name borrower / co-borrower till one working day prior to the date of Auction then the property will not be sold and all the bids received from the prospective bidders shall be returned to them without any liability / daim against M/s Muthoot Housing Finance Company Ltd. The borrower/guarantor/mortgage of LAN No. 16100073259, 16100010518 and 16100077037 are hereby given STATUTORY 15 DAYS NOTICE & The borrower/guarantor/mortgage of LAN No. 16100076829 are hereby given STATUTORY 30 DAYS NOTICE UNDER RULE6(2), 8(6) & 9(1) OF SARFAESI ACT to discharge the liability in full and pay the dues as mentioned above along with upto date interest and expenses within above mentioned days from the date of this notice failing which the Secured Asset will be sold as per the terms and conditions mentioned above. In case there is any discrepancy between the publications of sale notice in ENGLISH and VERNACULAR newspaper, then in such case the English newspaper will	 5. Vapi Ind Estate M/S Modern Petro Packaging Prop. 1. Mr. Satish B. Kapadi (Borrower:), 2. Mr. Dilip Karsan Patel (Guarantor) Shop No. 312-C, 3rd floor, Dattani Prism-1,IT Park, Old Survey no. 282, New Survey no. 257, 1. No. 3,4 & 5, , Village- Sandor, Taluka-Papd Vasai, Dist. Thane-401 207. Bounded:- NORTH: Vaccant Plot, WEST: Dattani Linear, EAST: Vaccant Plot, SOUTH: Dattani Square Mall Road.
assets. Please note description of properties is as mentioned above.		Date : 10/11/2020 Authorised Office
Place:- Rajkot, Date : 04.11.2020 Sd/- Authorised Officer, Kotak Mahindra Bank Ltd	Place : Gujarat, Date: 10/11/2020 Sd/- Authorised Officer, For Muthoot Housing Finance Company Limited	Place : Surat Indian Bank.











Roc.No.1809/2018/E1 DHARMAPURI MUNICIPALITY CORRIGENDUM ON NOTICE INVITING REQUEST FOR QUALIFICATION (Extension of Time)	Date. 06.11.2020 건	મમદાવાદ, મંગળવાર, તા.૧૦ નવેમ્બ	२,२०२०		\$	ાયના	ન્સિયલ એક્સપ્રેર	ส		q		
nviting RFQ for Construction of a New Bus Stand Infrastructure Project for Dharmapuri Municipality, Tamil Basis) including financial management and maintenance for a period of 25 years (Including 18 Months t d in the official website https://intenders.govin on 09.09.2020 and also in Times of India English daily &	& Construction Period) & The Hindu Tamil daily	PATIDAR			TD			LIOT				
109.09.2020 Due to the Administrative reasons , the last date of receipt of RFQ has been postponed to the RFQ already invited on RFQ postp	I		9999GJ1989PTC0			2			RIES LIM			
date for submission of Online : 10.11.2020 upto 14.00 hrs online: 09.12.2020 up	upto 14.00 hrs	Regd. Off.: Lati Bazar, Jo Email: patidarbuildconltd@r					TM REGD. OFFICE & WORKS Website:www.jsimogar.co		8 340, TAL. & DIST. ANAND, (Dislmogar.com	GUJARAT, INI		
ation addressed to The Offline on:11.11.2020 upto 15.00 hrs Offline on:10.12.2020 offline on:10.12.2020	20 upto 15.00 hrs	EXTRACT FROM THE STANDALONE	•			Sec. 142.127			IN:L31100GJ1966PLC001397			
pality, Dharmapuri		THE QUARTER AND HALF				EXT	RACT OF STATEMENT OF UNAUDITED					
e and time of Opening Application 11.11.2020 : 15.30 hrs 10.12 2020 : 15.30 h Application at Municipal Office. Dharmapuri at Municipal Office.	Dharmanuri			For the half vear ended on	Corresponding		HALF YEAR ENDED AS	Quarter	PTEMBER, 2020 (₹ In Lakha	-		
Q may be downloaded from the Official Website https://tntenders.gov.in upto 09.12.20			on y 30th September, 30 2020	,		Sr. No.	Particulars	30.09.	.2020 30.09.2020	30.09.20		
	1	Total income from operations	48.67	90.43	September, 2019 11.64		Income from Operations	UNAU	DITED UNAUDITED 1413 2280	UNAUDI 145		
NOTICE	2	 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 	(3.58)	28.83	(9.12)		rofit/(Loss) for the period		40 91	2		
e is hereby given that the Share Certificates issued by Hester Biosciences Lim		Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)		28.83	(9.12)		re tax, Exceptional and/or Extraordinary iter rofit/(Loss) for the period before tax	ns)	40 91	2		
ames of below mentioned shareholders have been reported lost/ misplac ations for issue of duplicate certificate in respect thereof has made to the (Net Profit / (Loss) for the period after Tax	(3.58)			(after	Exceptional and/or Extraordinary items)					
Pushpak, Panchavati Circle, Motilal Hirabhai Road, Ahmedabad 380006.	5 Solution State	(after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period	(3.57)	28.85	(9.12)		rofit/(Loss) for the period after tax Exceptional and/or Extraordinary items)		14 54	1		
No. Name of Share holder Distinctive No. Certificate No. M	No. of Shares	[Comprising Profit/ (loss) for the period (after tax) & other Comprehensive Income (after tax)]	(3.57)	28.85	(9.12)	5 Total	Comprehensive income for the period		14 53	(3		
10 1. Anand Niranjan Modi 2235301 · 2235400 11752 2. Mitesh Deepak Shah 8376079 · 8376128 26388	100 6 50 7	Equity Share Capital Reserves (excluding Revaluation Reserve)	550.05	550.05	550.05		prising Profit/(Loss) for the period (after tax ther Comprehensive income (after tax)])				
2. Milesii Deepak Silaii 6370079 · 0370120 20300	150	as shown in the Audited Balance Sheet		141.21	110.21		y Share Capital		117 117	11		
47 Jaiprakash Solanki 2605001 - 265100 15449	100 8	Earnings Per Share (of Rs. 10 / - each)		141.21	110.21		r equity ngs Per Share (of₹ 10/- each)		140.	<u> </u>		
8390089 - 8390138 26641	50 150	(for continuing and discontinued operations) Basic :	(0.06)	0.52	(0.17)	1) Ba			1.23 4.60	1.0		
erson having claims / objections in respect of the said Shares, should comr		Diluted : The above is an extract of the detailed format of Q	(0.06)	0.52 sults filed with the	(0.17) e Stock Exchange	2) Dil			1.23 4.60	1.0		
any at the Registered Office or to the Registrar and Share Transfer Agent	t at the address	under Regulation 33 of SEBI (Listing and Other Dis	closure Requirements	s) Regulation, 20)15. The full Format		he above is an extract of the detailed forr Results filed with the Stock Exchange u					
below within 15 (Fifteen) days from the date of this advertisement, else th eed to issue duplicate certificate after expiry of 15 (Fi	ifteen) days	of the financial Results are available on the St Company website (www.patidarbuildconltd.in)	0	,	, I		e Requirements) Regulations, 2015. The re available on the Stock Exchange webs					
strar and Share Transfer Agent: Link Intime India Private Limited 5th Flo	oor, 506 to 508,	2 The result of the Quarter ended on 30th Septen approved by the Board of Director at its meeting hel	d on 9th November, 202)20.			nogar.com.	ite www.bsen				
rnath Business Centre – I (ABC·I), Beside Gala Business Centre, Nr. St. X er, Off. C. G. Road, Elliesebridge, Ahmedabad 380006	-			FOR, PATIDAR	D OF DIRECTORS R BUILDCON LTD.	Place : \	adodara		FOR JSL IND Rahul	OUSTRIES L N. Amin		
· · · · · · · · · · · · · · · · · · ·		Place : AHMEDABAD Date : 09-11-2020	SD/- RAJNIKANT R. I	PATEL (MANAG	(DIN-01218436)		9.11.2020		(Chairman) [DIN:00167		
इंडियन बैंक indian Ba र इलाहाबाद ALLAHABAD सिड्योरीटी एल्टरेस्ट (ओनझोर्समेल्ट)नियमो, २००२ ना नियम	нн	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (૦૫ ઈ-મેલઃ zo.ahm	∞૯) ૨७૪૩૫૬૬૩, edabad@india	, २७४३२२४८ anbank.co	p.in	૨७૪૩૯૬૬૮,	મેગા ઇ– અચલિત મિલકતોના વે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ	ચાણ માટે	ટે (જુઓ રૂલ નં.	((۶))		
د इलाहाबाद ALLAHABAD सिड्योरीटी एन्टरेस्ट (अनझेर्समेन्ट)नियमो, २००२ ना नियम अदेर प्रनताने सामान्य रीते अने इरुप्रदार/रो अने प्रभीनदार/रो, औरोदार/रो आ नीट	મમ ૮(୨)ની જોગવાઇઓ ટેસથી જગાવવામાં આવે છે.કે	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (૦૫ ઈ-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વાગેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે (૦૯) ૨૦૪૩૫૬૬૩, edabad@india રીકન્સ્ટ્રક્શન ઓ ગરવે/ચાર્જરાખેલ છે જે	, ૨७૪૩૧૨૪૮ anbank.co તેફ ફાચનાનિ લો સાંકેતિક કબ	ડ, ફેક્સ : (૦૯૯)).in ક્સિચલ એસેટ્સ ર જોઇલ્ડિયન બેંક. સિક્	૨७४३૯୫୫૮, મને એનફોર ^{યોર્ડ ક્રેડિટરના અ}		ચાણ માટે ટ, ૨૦૦૨ હેઠ વ્યાંછે'. 'વેછેટે	र्ट (अुआ) ३स नं. 50 स्थावर भिल ड तोना दे 18' अने 'केडांशिवेश'ना आह	૮ (୨)) વેચાણ માટે ^{પ્રો} ટે નીચે આપેલ		
د इलाहाबाद ALLAHABAD સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિચમો, ૨૦૦૨ ના નિચમ જોટેર બનતાને સામાન્ય રીતે અને કરબદાર/રો અને ભમીનદાર/રો, ગીરોદાર/રો આ નોટિ તારીખે જે તે કરબદાર/રો અને ભમીનદાર/રો, ગીરોદાર/રો પાસ્ટ્રે ક્રેડિટરે લેવાન ક્રમ હિલ્લરક્રવલ્યો (ભગીનદાર) (પોર્પેજરોન નાય અને આપ્યત નાય	મમ ૮(୨)ની જોગવાઇઓ ટેસથી જગાવવામાં આવે છે.કે	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (૦૫ ઈ-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f ર વેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ	૦૯) ૨૦૪૩૫૬૬૩, edabad@india રીકન્સ્ટ્રક્શન ઓ ગરવે/ચાર્જરાખેલ છે જે	, ૨७૪૩૧૨૪૮ anbank.co તેફ ફાચનાનિ લો સાંકેતિક કબ	ડ, ફેક્સ : (૦૯૯)).in ક્સિચલ એસેટ્સ ર જોઇલ્ડિયન બેંક. સિક્	૨७४३૯୫୫૮, મને એનફોર ^{યોર્ડ ક્રેડિટરના અ}		ચાણ માટે ટ, ૨૦૦૨ હેઠ વ્યાંછે'. 'વેછેટે	र्ट (अुआ) ३स नं. 50 स्थावर भिल ड तोना दे 18' अने 'केडांशिवेश'ना आह	૮ (୨)) વેચાણ માટે પ્રારે નીચે આપેલ ામાં આવે છે."		
દેશ इलाहाबाद ALLAHABAD સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિચમો, ૨૦૦૨ ના નિચમ જોઢેર જનતાને સામાન્થ રીતે અને કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ લારીખે જે તે કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ કમ ન. ઉધારકર્તાઓ / જામીનદાર/ મોર્ગેજરોનું નામ અને શાખાનું નામ ૧. બાયર કોર્પોરેશન (પ્રોપરાચટરશીપ	મમ ૮(୨)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે ની થતી સ્ક્રમની વસૂલાત માટે ત વ ગોહીલના નામે સ્હેલ ટેનામે	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ ઈ-મેલ: ટ0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે (વેચાણ થશે. સ્પ્રિડ મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે (વેચાણ થશે. સ્પ્રિડ દેમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ્ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિથા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં	oe) ૨७૪૩૫૬૬૩, edabad@india રીકન્સ્ટ્રક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે વ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્ષન 1.ચાર્ડ એટલે કે ૭૧.૦૭	, ૨૭૪૩૧૨૪૮ anbank.co મેક ફાચનાનિ મેનો સાંકેતિક કબ માં વર્ણન પણ નીચે મ ક ચો.મી. તેમજ બ	ટ, ફેક્સ : (૦૯૯) o.in ઝેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિયન બેંક, સિક્ આપેલ છે."સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ અંદાજ્	૨७૪૩૯૬૬૮, મને એનફોર શોર્ડ ક્રેડિટરના અ સ્ક્યામતો છોડાવ પ્રત ૪૫.૫૧ ચો.મી	અચલિત મિલકતોના લે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ત ધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે વાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ Rs. 39.22.036/-	ચાણ મા લે ૨, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન	છે (જુઓ રૂલ નં. 50 સ્થાવર મિલકતોના બે તેછે'અને 'જે કાંઈ છે તે છે'ના આદ (૮) તરફકરજદારનું ધ્યાન દોરવ	૮ (୨)) વેચાણ માટે પ્રારે નીચે આપેલ ામાં આવે છે." તો માટે સંપર્ક		
દે इलाहाबाद ALLAHABAD સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિચમો, ૨૦૦૨ ના નિચમ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નીતિ તારીખે જે તે કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નીતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નીતિ તારીખે જે તે કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિક્ચોર્ડ ક્રેડિટરે લેવાન કમ નં. 84 નં. 6ધારકર્તાઓ / જામીનદાર/ મોર્ગેજરોનું નામ અને શાખાનું નામ નં. 9 - ૧. બ્લાટ કોર્પોરેશન (પ્રોપરાચટરશીપ કંપની, દેવાદાર) - 9 - ૧. બ્લાટ કોર્પોરેશન (પ્રોપરાચટરશીપ - 9 - ૧. બ્લાટ કોર્પોરેશન (પ્રોપરાચટરશીપ - 9 - ૧. બ્લાટ કોર્પોરેશન (પ્રોપરાચટરશીપ -	મમ ૮ (\$) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે ની થતી સ્કમની વસૂલાત માટે વ વ ગોહીલના નામે સ્ટેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો જે ગામ - રખિયાલ, તાલુકો-	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ ઈ-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલક્ત જે સિક્ચોર્ડ કેડિટર પાસે (ર વેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર બિલક્ત	oe) ૨७૪૩૫૬૬૩, edabad@india રીકન્સ્ટ્રક્શન ઓ ગેસ્વે/શાર્જ રાખેલ છે જે શ્વાવ મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન ો.ચાર્ડ એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓટવ)	, ૨७૪૩૧૨૪૮ anbank.co મેફ ફાચનાનિ જેનો સાંકેતિક કબ માં વર્ણન પણ નીચે મ ગ ચો.મી. તેમજ બ ાયટી લીમીટેડ તરી), જિલ્લો અમદાલ	2, ई 5 સ: (०७९)).in ਨੋ સચલ એસેટ્સ ર ਐ ઇन્ડिચન બેંક , સિક આપેલ છે."સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ અંદાઉ શેકે જાણીતી સ્ક્રીમમાં , ટા વાદ , ગુજરાત રાજ્ય ખ	૨७૪૩૯૬૬૮, મને એનફોર થોર્ડ ક્રેડિટરના અ સ્કચામતો છોડાવ ત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાભિંગ સ્ક્રી ⁹	अचलित मिलङतोजा थे भिन्ट ओફ सिड्योरीटी छन्टरेस्ट એક્ત दिड्त अधिडारी द्वारा वेवामां आव्यो छे એનું 'જેमछे दानी ઉपलव्ध समय मर्याहा અંગે डायहाना सेड्शन व सुरक्षित जाडी रडम ह. 39,22,036/- ता. १६.०८. १०१८नी डिमान्ड नोटीस	ચાણ મા લે ૨, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન	ર (જુઓ રૂલ નં. 50 સ્થાવર મિલકતોના વ લેછે' અને 'જે કાંઈ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત	૮ (୨)) વેચાણ માટે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in,		
દેશ इलाहाबाद ALLAHABAD સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિચમો, ૨૦૦૨ ના નિચમ જોઢર જનતાને સામાન્થ રીતે અને કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ જોઢર જનતાને સામાન્થ રીતે અને કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ લારીખે જે તે કરુજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ કમ ન. ઉદ્યારકર્તાઓ / જામીનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિક્ચોર્ડ કેડિટેર લે તેવન જેમ ન. ૧ ૧. બ્રાઇટ કોર્પોરેશન (પ્રોપરાઘટરશીપ કંપની, દેવાદાર) ૧. બ્રાઇ નંદર(ભા શારદા મંદિર (d-અને)) શાખા: જુના શારદા મંદિર (d-અને)) શે જગદિશભાઇ ઇસ્વરભાઇ પટેલ (દેવાદાર, ગીરવેદાર અને પ્રોપરાઘટર) શો જગદિશભાઇ ઇસરભાઇ પટેલ (દેવાદાર), ગીરવેદાર અને પ્રોપરાઘટર) શો જગદિશભાઇ પલાભાઇ મરેલભાઇ પટેલ (દેવાદાર), ગીરવેદાર અને પ્રોપરાઘટર) શો જોઠારભાઇ પટલ (દેવાદાર)	મમ ૮ (૬)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે ન ની થતી સ્કમની વસૂલાત માટે ન લ ગોહીલના નામે સ્હેલ ટેનામે s ફ્લોસ્ + એમસી મુજબ પહેલો ોજે ગામ - રખિશાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમાં: ઉત્તર: વર્દાન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીકે જાણીતી સ્કીમમાં ન વહેશા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ-	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નેચે વર્ષવેલ સ્થાવર મિલક્ત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે લેવેચાણ થશે. સ્ઝિર્ડ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર વેચાણ થશે. સ્ઝિર્ડ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર વેશાણ થશે. સ્ઝિર્ડ કેસ્ટ્રિટર (સે ગ્રેને મિલક્ત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિયા ક્ષેત્રક્ઝ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્થ્યુઅલ ક -મણીનગર, સ્જીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ ઘટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં બી/૧૮, ૩૬ માળ, ાયેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૬ ચો.મી., રેવન્થુ સર્વે નં.૧૫૪ પૈક્	pe) ૨७४३૫૬૬૩, edabad@india રીકન્સ્ટ્રક્શન ઓ ગેરવે/ચાર્જ રાખેલ છે જે થ્યાવર મિલક્તનું ટૂંકમાં નું વિગતવાર વર્દાન નું વિગતવાર વર્દાન શે.ઓપ.ઢાઉસીંગ સોસા અમદાવાદ - ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ , પશ્ચિગ સોમફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર	, ૨७૪૩૧૨૪૮ anbank.co મેફ ફાચનાનિ તેનો સાંકેતિક કબ માં વર્ણન પણ નીચે : ગ સાંકેલી સીટેડ તર્), જિલ્લો અમદાલ માં ટેનામેન્ટ નં એએમસી ટેક્સ બી ન પ્લાનિંગ નં .(નિ રાજ્ય ખાતે આવેલ	ડ, ફેક્સ : (૦૭૯)).in જેસચલ એસેટ્સ ર જો ઇન્ડિયન બેંક, સિક્ત આપેલ છે. "સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ અંદાજ્ માંધકામ ક્ષેત્રફળ બંદાજ્ માંધકામ સેત્રફળ અંદાજ્ ના સુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન લ ફ્રીહોલ્ડ રેસીડેન્સીયલ	૨७४ ३૯૬૬૮, મ ને એનર્ફોર થોર્ડ ક્રેડિટરના અ સ્ક્યામતો છોડાવન્ તુત ૪૫.૫૧ ૨૫.મી ઉલ પ્લાભિંગ સ્ક્રીય તુત ૪૫.૫૧ ૨૫.મી લ પ્લોટ નં.૩, મોર્ગ મિલકતના તમાય	अचलित भिसङतोजा थे भिन्ट ओફ सिड्योरीटी छन्टरेस्ट એક્ત દિકૃत अधिકारी द्वारा वेवामां आव्यो छे छेनुं 'વेभछे दानी ઉपतन्ध समय मर्याદा अंગे डायदाना सेडशन प सुरक्षित બाडी रडम Rs. 39,22,036/- ता. २६.०८.२०१८नी डिमाठ नोटीस मुक्ल + थे ते तारीण सुधीनुं व्याप अने पर्या, यार्श्वरा अने अन्य ખयांआे.	<mark>૨ાણ માર્ટે</mark> ૨, ૨૦૦૨ હેઠ ૧વ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન ૨ઝર્વ કિંમત ૨s. 57,92,000/-	દ (જુઓ રૂલ નં. જ આ સ્થાવર મિલકતોના બે તે છે' અને 'જે કાંઈ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દિપક કુમાર, શેક મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 ઇ-મેલ : zoahmrecovery@india	૮ (૬)) A ચાણ માટે ામં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in,		
હેડ इलाहाबाद ALLAHABAD સિક્સોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિચમો, ૨૦૦૨ ના નિચમ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિક્યોર્ડ કેડિટરે લેવાન જાતી કરજદાર/રો અને જમીનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિક્યોર્ડ કેડિટરે લેવાન કમ ન. ઉદ્યારક્તાઓ / જામીનદાર/ માગેજરોનું નામ અને શાખાનું નામ ૧ ૧. બાઇટ કોપેરિશન (પ્રોપરાઘટરશીપ કંપની, દેવાદાર) મિલકતનું વર્દાન : શ્રી સેમસન પોલ (રેગ્યુલરાઇઝડ પ્લાન મુજબ ગાઉલ્ડ નં.૧૧, ફાઇનલ પ્લોટ લં. ૧૫૭, મોવ મિલકતના તમામ ભાગ અને હિસ્યા. ૧ ૧. બાઇટ કોપેરિશન (પ્રોપરાઇટરશીપ શાખા : જુના શારદા મંદિર (ઇ-એન્ડ)) મિલકતનું વર્ટાર બે લગ્લ તર્ટ સો જગદિશભાઇ ધલાભાઇ મકલાણા (જમીનદાર) શો ભ્રેશ કનુભાઇ પ્રજાપતિ (જમીનદાર) શાખા : શેલીફ રોડ (ઇ-એબી) મિલકતનું બ એતન્યુ તર્ટ (સીમ) નિર ભાગ અને	મેમ ૮ (૬)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ લ ગોહીલના નામે સ્હેલ ટેનામે ક ફ્લોર + એમસી મુજબ પહેલો)જે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમા: ઉત્તર: વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીકે જાણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર: પ્લો	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલક્ત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f વેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્ભેસ્ટ મની ડિપોઝીટ અને સ મિલક્ત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં મે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ: ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ ઘરભાઇ પટેલના નામે રહેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૧ો માળ, ાચેલ ઢિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., રેવન્ચુ સર્વે નં. ૧૫૪ પૈટ ાન સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) અને જિલ્લો તોટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ	pe) ૨७૪૩૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે થ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્ષન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ ૭ (ઓઢવ) ત્રામેન્ટ નં. ૧૦-એ, પશ્ચિમ સેમફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં. ૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર : પ્લોટ નં.૩ પેકી, પશ્ચિમ	, ૨૭૪૩૧૨૪૮ anbank.co તેને સાંકેતિક કબ માં વર્ણન પણ નીચે ર ગ સાંકેતિક કબ માં વર્ણન પણ નીચે ર ગ સાંકેતિક કબ ગ સાંકે ત્રામેન્ટ નં.લ- પ્રેએમસી ટેક્સ બી ન પ્લાનિંગ નં.(નિ રાજ્ય ખાતે આવેલ મ:ટાઉન પ્લાનિંગ	દ, ફેક્સ: (૦૭૯) D.in જેસચલ એસેટ્સ ર ાજે ઇન્ડિયન બેંક, સિક્ આપેલ છે. 'સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ અંદાઉ શેકે જાણીતી સ્ક્રીમમાં, ટા વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો શેલ સુજબ ૧૪.દ્દપ ચો.મી કોલ-ર-પિચાલ), ફાઇન વ ફીહોલ્ડ રેસીડેન્સીચલ સ્ક્રીમનો રોડ. સાંકેતિક	૨७૪ ૩૯૬૬૮, મને એનફોર થોર્ડ ક્રેડિટરના અ સ્ક્ચામતો છોડાવ ક્રાયતો છોડાવ ડા ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીગ તે આવેલ સ્થાવર તો આવેલ સ્થાવ તો તેમજ શિરોમાર્થ મિલકતના તમામ કલ્યો	અચલિત મિલકતોના વે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘાની ઉપલબ્દ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ • Rs. 39,22,036/- • Rs. 39,22,036/- • તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાનડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ચ ખચાઓ).	<mark>૨ાણ માર્ટે</mark> ૨, ૨૦૦૨ હેઠ ૧વ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન ૨ઝર્વ કિંમત ૨s. 57,92,000/-	કે (જુઓ રૂલ નં. જ કળ સ્થાવર મિલકતોના બે તે છે' અને 'જે કાંઈ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દિષક કુમાર, ચીફ મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798	૮ (૬)) વે ચાણ માટે ામે આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in,		
क्रिङ्लाहाबाद ALLAHABAD सिड्योरीटी छन्टरेस्ट (ओनइोर्समेन्ट) नियम), २००२ ना नियम सिड्योरीटी छन्टरेस्ट (ओनइोर्समेन्ट) नियम), २००२ ना नियम शांभान्व्य टीते अने इट्लहाट/रो अने लभीनहाट/रो, गीरेहाट/रो आ नोति सिड्योरीटी छन्टरेस्ट (ओनइोर्समेन्ट) नियम), २००२ ना नियम शांभान्व्य टीते अने इट्लहाट/रो अने लभीनहाट/रो, गीरेहाट/रो आ नेति शांभान्व्य टीते अने इट्लहाट/रो अने लभीनहाट/रो, गीरेहाट/रो आसे निर्देधाट/रो आसे की किड्योर्ड ईटिटटे देवान का विद्यारडतांग / लभीनहाट/ / भोर्जेल्टोर्नु नाम अने शाणानु नाम १ ९. द्वाइट डोर्गेरिशन (भोपराघटरशीप इंपनी, टेवाइार) अमितहाट अने गीटवेहार) शाणा : रुना शारहा मंहिर (ई-अनेजी) सिख्डतनुं वर्दान : श्री सेसल पोत (२२ से. खुडालाई मंड्रलाई परेब (टेवाहार, गीटवेहार अने भोपराघटरायर) औ रुपहालार्ड मंहिर (ई-अनेजी) सिख्डतना तमाम (मांग अने हिट्ला (रोभ) निद (रोभ) निर्दा साणा : रीतीं ह रोड (ई-ओजी) शाणा : रीतीं इरोड (ई-ओजी) शाणा : रीतीं इरोड (ई-ओजी) भी अगेहिशालार्ड मंडला (भागेनहार) औ लभेडर बुलुलाई प्रथाप्त (लगीनहार) शाणा : रीतीं इरोड (ई-ओजी) भी अनेहरलाल पेपाराम हरक्ष सिइटरला प्रयास हरक्ष	મેમ ૮ (૬)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ લ ગોઢીલના નામે સ્ઢેલ ટેનામે ક ફ્લોસ્ + એમસી મુજબ પઢેલો ોજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલક્તની ચતુ:સીમાં: ઉત્તર: વર્દાન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીકે જાણીતી સ્કીમમાં ન વઢેચા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ હિસ્સા. ચતુ:સીમાં: ઉત્તર: પ્લો	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ચેચાણ થશે. સ્ઝિર્ડ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફ્ળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, ૨જીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, ૨જીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - ચાયાબ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.પી/૧૮, ૩૧ો માળ, ાથેલ ઢિસ્ટ્રી ક્ષેત્રફળ ૩૪ ચો.મી., રેવન્થુ સર્વે નં.૧૫૪ પૈક્ તોટ નં.૨પૈકી,દક્ષિણ:ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ થલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩	be) ૨७४३૫૬૬३, ledabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/રાર્જ સાખેલ છે જે શ્વાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન નું વિગતવાર વર્શન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નરૂળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૬ અમદાવાદ, ગુજરાત ૬ અમદાવાદ, ગુજરાત ૬	, २७४३९२४८ anbank.co गोइ इायनानि रेनो संडेतिङ इज सं वर्धन पए नीचे व सो मी. तेमक ज । वर्धन पए नीचे), किस्सो अमहात म: टेनामेन्ट नं फ्रेअेमसी टेड्स जी न प्रदालिंग नं म र्यालिंग नं म राधलि प्रदालिंग सं राधिन प्रदालिंग	દ, ફેક્સ: (૦૭૯) D.in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક , સિક્ આપેલ છે. "સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રકળ અંદાણ શેકે જાણીતી સ્કીમમાં, ટા વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો ોલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન વ ફીહોલ્ડ રેસીડેન્શીયલ સ્કીમનો રોડ. સાંકેતિક	૨ હેઝ 3 ૯ ૬ ૬ ૮ , મ ને એન ફોર શેર્ડ ક્રેડિટરના અ સ્કચામતો છેડાવ ટ્રાત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો અવેલ સ્થાવ ને તેમજ શિરોમાઈ મિલકતના તમાગ કબજો થો.મી. શ્રીભે માળ	અરાવિત મિલકતોના વે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે દ્વાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાચદાના સેક્શન વ સુરक्षित બાકી રકમ -	<mark>૨ાણ માર્ટે</mark> ૨, ૨૦૦૨ હેઠ ૧વ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન ૨ઝર્વ કિંમત ૨s. 57,92,000/-	દે (જુઓ રૂલ તં. જ ડળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દિષક ફુમાર, શ્રીફ મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ ફુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba	C (୨)) Aચાણ માટે મારે નીચે આપેલ માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in,		
હે इलाहाबाद ALLAHABAD (२) अने आधार के स्वयाद (२) अने अधार के स्वयाद (२) अने आधार के आधार के स्वयाद (२) अने आधार के आधार के स्वयाद (२) अने के आधार के स्वयाद (२) अने के आधार के स्वयाद (२) अने आधार (२) अने अधार (२) अने आधार के स्वयाद (२) अने आधार (२) अने अधार (२) अने आधार (२) अने आधार के स्वयाद (२) अने आधार (२) अने अधार (२) अने आधार (२) अने अधार (२) अने आधार (२) अने अधार (२) अने आधार व्य के आधार व्य	મમ c(\$)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે ન ની થતી સ્કમની વસૂલાત માટે વ લ ગોઢીલના નામે સ્ટેલ ટેનામે 5 ફ્લોર + એમસી મુજબ પહેલો જે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમાં ઉત્તર: થર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ ટીકે જાણીતી સ્કીમમાં ઉત્તર: પ્લે ટિસ્સા. ચતુ:સીમાં ઉત્તર: પ્લે રજીના નામે સ્ટેલ સ્ટેસીડેન્સીચ ઇનલ પ્લે ટનં. સ્ટ/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે વેચાણ થશે. રિઝર્વ કિંમત, અનેંસ્ટ મની ડિપોઝીટ અને જ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ: ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ ઘટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩જો માળ, માંચેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., દેવન્યુ સર્વે નં.૧૫૪ પૈક્ ના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) અને જિલ્લો તોટ નં.૨ પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્કીમનો રોડ, પુર્વ વલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એસ્ટિયા ૫૧.૩ મર્વે નં. ૫૮૨/૩), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફીઢોલ્ડ દેસીડેન્સીચલ	pe) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્ણન આયદાવાદ- ૭ (ઓટવ) તામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નફળ ૩૭ રો.મી.(એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ : પ્લોટ નં.૩ પેકી, પશ્ચિમ c રો.મી. તેમજ જમીનન રો.મી. સેગ્નફળ ઘરાવટ	ર હજ ૩૧૨૪૮ anbank.co તેને સાંકેતિક કબ તેને સાંકેતિક કબ તે સાંકેતે સાંકેતે સાંકે તે સાંકે સાં	દ, ફેક્સ: (૦૭૯) D.in જેસચલ એસેટ્સ ર બેજે ઇન્ડિચન બેંક , સિક્ આપેલ છે. 'સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ બંદાર્ શેકે જાણીતી સ્ક્રીમમાં , ટા વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો વેલ મુજબ ૧૪.૬૫ ચો.મી દાકેત-રખિયાલ), ફાઇન વ ફ્રીહોલ્ડ રેસીડેન્સીચલ સ્ક્રીમનો રોડ. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮.૬૦ મક જમીનમાં મોજે: વટવા	રે હ૪ ૩૯૬૬૮, મને એનફોર થોર્ડ ક્રેડિટરના અ સ્કચામતો છોડાવ દ્રાત ૪૫.૫૧ રો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીમ તે આવેલ રથાવ તે આવેલ રથાવ તે આવેલ રથાવ તે આવેલ રથાવ તે અવે સ્થાપ્ય કે બજો થો.મી. ત્રીજો માળ , તાલુકો : દસ્ક્રોઇ	અરલિત મિલકતોના લે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ચિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી સ્ક્રમ • ૨ • ૧ •	<mark>૨ાણ માર્ટે</mark> ૨. ૨૦૦૨ હેઠ ૧વ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન ૨ઝર્વ કિંમત ૨s. 57,92,000/-	દે (જુઓ રૂલ તં. જ કળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દિષ્ક કુમાર, શ્રીફ મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmecovery@india zoahmedabad@indianba ધ-મેલ : zoahmrecovery@india g-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba	C (୨)) વેચાણ માટે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in મેનેજર nbank.co.in, nk.co.in		
હि इलाहाबाद ALLAHABAD सिड्योरीटी ઇन्टरेस्ट (એनर्ज्ञोरीमेन्ट) नियम), २००२ ना नियम Albavantian Albavalose	મમ c(\$)ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે ત ની થતી સ્કમની વસૂલાત માટે ત ના થતી સ્કમની વસૂલાત માટે ત ક બોદીલના નામે સ્ટેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો બે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમાં ઉત્તર: વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ ટીકે ભણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રઝુસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમાં ઉત્તર: પ્લો ઇનલ પ્લો ટનં. ર૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬, સોકે તિલાલ અદેસરા ના નામે સ્ટેલ થ ખાતે આવેલ ફી હોલ્ડ સેસીડે	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: ZO.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે વેચાણ થશે. રિઝર્વ કિંમત, અનેંસ્ટ મની ડિપોઝીટ અને જ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ: ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ ઘટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩જો માળ, માંચેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., દેવન્યુ સર્વે નં.૧૫૪ પૈક્ ના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) અને જિલ્લો તોટ નં.૨ પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્કીમનો રોડ, પુર્વ વલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એસ્ટિયા ૫૧.૩ મર્વે નં. ૫૮૨/૩), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફીઢોલ્ડ દેસીડેન્સીચલ	ee) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેરવે/સાર્જ સખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્ણત નું વિગતવાર વર્ણત ગામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ અમદાવાદ, ગુજરાત ૨ :પ્લોટ નં.૩ પેકી, પશ્ચિમ લ સો.મી. તેમજ જમીનન રો.મી. સેમફળ ધરાવત નામેલકતના તમામ ભાગ નગર, જમીન સેગ્રફળ ૪	ર હજ ૩૧૨૪૮ anbank.co તેને સાંકેતિક કબ તેને સાંકે ક્લે તેને સાંકે સાંકે સાંકે તેને સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે સાંકે	દ, ફેક્સ: (૦૭૯) D.in જેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિયન બેંક , સિક આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર્ ગાંધકાન ક્ષેત્રફળ વડ દ્વ સ્ક્રીયના રોડ . સાંકેતિક સ્ક્રીયના રોડ . સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮ દ્વ ા ક જમીનમાં મોજે: વટવા લક્ત્તની ચતુ:સીમા : ઉત્ત	રે હ૪ ૩૯૬૬૮, મને એનફોર થોર્ડ ક્રેડિટરના અ સ્કચામતો છોડાવ પ્રત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીગ તા ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીગ તો આવેલ સ્થાવર .) તેમજ શિરોમાર્ણ મલકતના તમાગ કબ્ભે થો.મી. ત્રીભે માળ , તાલુકો દરક્રોઇ ાર : કોમન ગાર્ડન , માધાપર, તાલુક	관리(G)(C) (취용:Schort) (C) (ਮੈಂਟ ओई सिड्योरीटी एक्टरेस्ट येक्ट (ਸੈਂਕਟ ਅ)(ਡ ਲੀ, ਕ) (1, 1) (ਸ਼ੇਕਟ ਅ) (ਸ਼ੇਕਟ ਅ)(ਡ ਲੀ, ਕ) (ਸ਼ੇਕਟ ਅ)	<mark>૨ાણ માર્ટે</mark> જ્યાં છે', 'જે છે ટે ૩ના સબ-સેક્શન રિઝર્વ કિંમત રિડ. 57,92,000/- Rs.14,00,000/-	દે (જુઓ રૂલ તં. જ ડળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ ચારતો અને નિચમોની વધુ વિગત શ્રી દેષક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી દેવાલાલ છેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba	C (୨)) વેચાણ માટે મારે નીચે આપે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in, nk.co.in જર ubank.co.in,		
દ इलाहाबाद ALLAHABAD (ALLAHABAD) (ALLAHABAD) <td <="" colspan="2" td=""><td>મેમ c ((s) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ વા ગોહીલના નામે સ્હેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો ાજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમા: ઉત્તર: . વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દોકે જાણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર: પ્લો રજીના નામે સ્હેલ રેસીડેન્સીચ ઇનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬. સોકે તિવાલ અદેસરા ના નામે સ્હેલ ય ખાતે આવેલ ફી હોલ્ડ રેસીડે s કળવો j વર્ધન : શ્રી લાખજી આસુજી બ ધકામ ક્ષેત્રફળ ૭૯. ૩૫ ચો. મી.)) જુનો સર્વે નં. 9૭૮, ૭૮૩, ૭૩, ૭</td><td>મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ગ્રેચાણ થશે. સ્ઝિર્ડ ક્રિંગત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચે મે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સ્વામેન્ટ નં.૨-એ, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ માં સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તોટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ચલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩ મર્વ નં.૫૨૮૩), ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ક્લિક કબ્જો લ સબ પ્લોટ નં. રા૩-ડી, રેવન્ચુ સર્વે નં.૧૪૨, પ્રાશ્વનાથ ડેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકત્વની ગારોટના નામે સ્ટેલ હાઉસ નં. ઈ-૮૮, પ્લોટ એરિયા ક્ષેત્રક બ્રેડ , હલ્પ, બ્લ્દ, બ્લ્ટ અને ૮૧૩) ક્ષેત્રફળ અંદાજીત સ્ટ</td><td>ec) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટૂક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર યાવેટ નં.૩ પૈકી, પશ્ચિમ લે ચો.મી. લેમજ જમીનન્ ચો.મી. લેમજ જમીનન્ વગર, જમીન લેમઝકળ ધરાવત વગર, જમીન લેમઝકળ દ ચતુ:સીમા: ઉત્તર: પ્લોટ</td><td>, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co iaiaiana i aiaiana ao i aiaiana i aiaia i aiaiana i aiaiana i aiaia i aiai i ai i ai ai ai ai ai ai ai ai ai ai ai ai ai a</td><td>૮, ફેક્સ: (૦૯૯)).in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક, સિક્સ આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ શે બાયેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ રા સાથેલા સ્ટેલ્સા સેત્રક બાયેલ સે પ્રેલ્સ સે સ્ટેલ્સી વાદ, ગુજરાત રાજ્ય ખ ન્સે. સાંકેલિક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો લેસ્સો સેત્રકળ ૧૮.૬૦ ક હા જમીનમાં મોજે: વટવા લક્સ્તાની ચતુ:સીમા : ઉત્ત મને તેના પરનું બાંધકામ : સબ પ્લોટ નં. ૩૩- છ, પુ જમીનમાં ન વઢેશાચેલ હિ i. ૩૮૫ પૈકી ૪ (પ્લોક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન</td><td>રેજ 3 લે કરે કે મને એનફોર થોર્ડ કેડિટરના અ સ્કચામતો છેડાવ પ્રાત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો સાંધા સ્ક્રો મિલકતના તમામ કબ્લે ધો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્કોઇ દર કોમન ગાર્ડન , માધાપર, તાલુક દ્ર : અંદરનો રોડ , સાધવર, સ્વ ર્ડ : અંદર અને ડેસ્ટ્રી ક્ટ અને સવલત ડેટ્ટ્રીક્ટ અને સવલત</td><td>અરસલિત મિલકતોના લે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ દિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે દાनी ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 9,94,448/- તા. ૨૪.૦૫.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ , ચાર્જીસ અને અન્થ ખરાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ</td><td><mark>રાણ માર્</mark> ર, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે તે ગ્રા રાબ-સેક્શન રિઝર્વ કિંમત શ. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/-</td><td>દ (જુઓ રૂલ તાં. જ ડળ સ્થાવર મિલકતોના દ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દોષ્ક કુમાર, શેક મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી દેવાલાલ લેસ્વા, ચીફ મેને મો.: 8968370384 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી શબ્દ શ્રુમાર સિંઘ, શીફ મેને મો.: 9458218596 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar</td><td>C (S)) Aચાણ માટે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in, nk.co.in mbank.co.in, nk.co.in જર bbank.co.in, ik.co.in</td></td>	<td>મેમ c ((s) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ વા ગોહીલના નામે સ્હેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો ાજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમા: ઉત્તર: . વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દોકે જાણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર: પ્લો રજીના નામે સ્હેલ રેસીડેન્સીચ ઇનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬. સોકે તિવાલ અદેસરા ના નામે સ્હેલ ય ખાતે આવેલ ફી હોલ્ડ રેસીડે s કળવો j વર્ધન : શ્રી લાખજી આસુજી બ ધકામ ક્ષેત્રફળ ૭૯. ૩૫ ચો. મી.)) જુનો સર્વે નં. 9૭૮, ૭૮૩, ૭૩, ૭</td> <td>મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ગ્રેચાણ થશે. સ્ઝિર્ડ ક્રિંગત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચે મે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સ્વામેન્ટ નં.૨-એ, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ માં સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તોટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ચલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩ મર્વ નં.૫૨૮૩), ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ક્લિક કબ્જો લ સબ પ્લોટ નં. રા૩-ડી, રેવન્ચુ સર્વે નં.૧૪૨, પ્રાશ્વનાથ ડેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકત્વની ગારોટના નામે સ્ટેલ હાઉસ નં. ઈ-૮૮, પ્લોટ એરિયા ક્ષેત્રક બ્રેડ , હલ્પ, બ્લ્દ, બ્લ્ટ અને ૮૧૩) ક્ષેત્રફળ અંદાજીત સ્ટ</td> <td>ec) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટૂક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર યાવેટ નં.૩ પૈકી, પશ્ચિમ લે ચો.મી. લેમજ જમીનન્ ચો.મી. લેમજ જમીનન્ વગર, જમીન લેમઝકળ ધરાવત વગર, જમીન લેમઝકળ દ ચતુ:સીમા: ઉત્તર: પ્લોટ</td> <td>, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co iaiaiana i aiaiana ao i aiaiana i aiaia i aiaiana i aiaiana i aiaia i aiai i ai i ai ai ai ai ai ai ai ai ai ai ai ai ai a</td> <td>૮, ફેક્સ: (૦૯૯)).in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક, સિક્સ આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ શે બાયેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ રા સાથેલા સ્ટેલ્સા સેત્રક બાયેલ સે પ્રેલ્સ સે સ્ટેલ્સી વાદ, ગુજરાત રાજ્ય ખ ન્સે. સાંકેલિક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો લેસ્સો સેત્રકળ ૧૮.૬૦ ક હા જમીનમાં મોજે: વટવા લક્સ્તાની ચતુ:સીમા : ઉત્ત મને તેના પરનું બાંધકામ : સબ પ્લોટ નં. ૩૩- છ, પુ જમીનમાં ન વઢેશાચેલ હિ i. ૩૮૫ પૈકી ૪ (પ્લોક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન</td> <td>રેજ 3 લે કરે કે મને એનફોર થોર્ડ કેડિટરના અ સ્કચામતો છેડાવ પ્રાત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો સાંધા સ્ક્રો મિલકતના તમામ કબ્લે ધો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્કોઇ દર કોમન ગાર્ડન , માધાપર, તાલુક દ્ર : અંદરનો રોડ , સાધવર, સ્વ ર્ડ : અંદર અને ડેસ્ટ્રી ક્ટ અને સવલત ડેટ્ટ્રીક્ટ અને સવલત</td> <td>અરસલિત મિલકતોના લે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ દિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે દાनी ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 9,94,448/- તા. ૨૪.૦૫.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ , ચાર્જીસ અને અન્થ ખરાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ</td> <td><mark>રાણ માર્</mark> ર, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે તે ગ્રા રાબ-સેક્શન રિઝર્વ કિંમત શ. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/-</td> <td>દ (જુઓ રૂલ તાં. જ ડળ સ્થાવર મિલકતોના દ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દોષ્ક કુમાર, શેક મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી દેવાલાલ લેસ્વા, ચીફ મેને મો.: 8968370384 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી શબ્દ શ્રુમાર સિંઘ, શીફ મેને મો.: 9458218596 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar</td> <td>C (S)) Aચાણ માટે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in, nk.co.in mbank.co.in, nk.co.in જર bbank.co.in, ik.co.in</td>		મેમ c ((s) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ વા ગોહીલના નામે સ્હેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો ાજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમા: ઉત્તર: . વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દોકે જાણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર: પ્લો રજીના નામે સ્હેલ રેસીડેન્સીચ ઇનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬. સોકે તિવાલ અદેસરા ના નામે સ્હેલ ય ખાતે આવેલ ફી હોલ્ડ રેસીડે s કળવો j વર્ધન : શ્રી લાખજી આસુજી બ ધકામ ક્ષેત્રફળ ૭૯. ૩૫ ચો. મી.)) જુનો સર્વે નં. 9૭૮, ૭૮૩, ૭૩, ૭	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ગ્રેચાણ થશે. સ્ઝિર્ડ ક્રિંગત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચે મે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સ્વામેન્ટ નં.૨-એ, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ માં સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તોટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ચલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩ મર્વ નં.૫૨૮૩), ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુર્વ ક્લિક કબ્જો લ સબ પ્લોટ નં. રા૩-ડી, રેવન્ચુ સર્વે નં.૧૪૨, પ્રાશ્વનાથ ડેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકત્વની ગારોટના નામે સ્ટેલ હાઉસ નં. ઈ-૮૮, પ્લોટ એરિયા ક્ષેત્રક બ્રેડ , હલ્પ, બ્લ્દ, બ્લ્ટ અને ૮૧૩) ક્ષેત્રફળ અંદાજીત સ્ટ	ec) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટૂક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર યાવેટ નં.૩ પૈકી, પશ્ચિમ લે ચો.મી. લેમજ જમીનન્ ચો.મી. લેમજ જમીનન્ વગર, જમીન લેમઝકળ ધરાવત વગર, જમીન લેમઝકળ દ ચતુ:સીમા: ઉત્તર: પ્લોટ	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co iaiaiana i aiaiana ao i aiaiana i aiaia i aiaiana i aiaiana i aiaia i aiai i ai i ai ai ai ai ai ai ai ai ai ai ai ai ai a	૮, ફેક્સ: (૦૯૯)).in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક, સિક્સ આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ શે બાયેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ રા સાથેલા સ્ટેલ્સા સેત્રક બાયેલ સે પ્રેલ્સ સે સ્ટેલ્સી વાદ, ગુજરાત રાજ્ય ખ ન્સે. સાંકેલિક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો લેસ્સો સેત્રકળ ૧૮.૬૦ ક હા જમીનમાં મોજે: વટવા લક્સ્તાની ચતુ:સીમા : ઉત્ત મને તેના પરનું બાંધકામ : સબ પ્લોટ નં. ૩૩- છ, પુ જમીનમાં ન વઢેશાચેલ હિ i. ૩૮૫ પૈકી ૪ (પ્લોક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન	રેજ 3 લે કરે કે મને એનફોર થોર્ડ કેડિટરના અ સ્કચામતો છેડાવ પ્રાત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો સાંધા સ્ક્રો મિલકતના તમામ કબ્લે ધો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્કોઇ દર કોમન ગાર્ડન , માધાપર, તાલુક દ્ર : અંદરનો રોડ , સાધવર, સ્વ ર્ડ : અંદર અને ડેસ્ટ્રી ક્ટ અને સવલત ડેટ્ટ્રીક્ટ અને સવલત	અરસલિત મિલકતોના લે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ દિકૃત અદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે દાनी ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 9,94,448/- તા. ૨૪.૦૫.૨૦૧૮ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ , ચાર્જીસ અને અન્થ ખરાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ	<mark>રાણ માર્</mark> ર, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે તે ગ્રા રાબ-સેક્શન રિઝર્વ કિંમત શ. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/-	દ (જુઓ રૂલ તાં. જ ડળ સ્થાવર મિલકતોના દ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દોષ્ક કુમાર, શેક મેને મો.: 9409602726 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી દેવાલાલ લેસ્વા, ચીફ મેને મો.: 8968370384 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar શ્રી શબ્દ શ્રુમાર સિંઘ, શીફ મેને મો.: 9458218596 ઇ-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbar	C (S)) Aચાણ માટે માં આવે છે." તો માટે સંપર્ક તેજર nbank.co.in, nk.co.in મેનેજર nbank.co.in, nk.co.in mbank.co.in, nk.co.in જર bbank.co.in, ik.co.in
মির্ক্রের্টারেরে ALLAHABAD মির্ক্ররাইটি ઇळ्टरेस्ट (એलङ्गेर्सभेन्ट)लियम), २००२ जा लियम প্রক্রির্টারেরেইংহ (ओलङ्गेर्सभेन्ट)लियम), २००२ जा लियम প্রক্রির্জ্ব কেলালे सामाब्य दीते अने इन्छ्रहाट/टो अने जमीनहाट/टो, जीरेहार/टो आ लोगि তার্টেম প্রি- বার্টিম প ते इन्छ्रहाट/टो अने जमीनहाट/टो, जीरेहार/टो आ लोगि अस्त अध्रिशन (भोपरायटरशी) मोर्जेप्टोनु वाम अने शाणानु जाम अस्त मेशन गोव गोवेति (भोपरायटरशी) मिल्डततां वर्धान मुल्प गाविड वं.१२, झाठलाद प्रोट वं. १९, भोरे प्रिवडतना तमाम (मांग अने हिस्सा) २ भी सेसल गोव गोवेति (भोपरायटर (भी नहाट) मिल्डतनां वर्धान मुल्प गाविड वं.१२, झाठलाद प्रोट वं. १५, भोरे सिंडतना तमाम (मांग अने हिस्सा) २ भी असल गोव गोदेहा?) शाणा : रुजा शारहा मंहिर (उं-छोती) मिल्डतनुं वर्धन : श्री सेमेरान गोल (२ औ भगहिशलार्ग प्रेस (१८)वाहा, गीदेहा?, गीददेहार अने भोपरायट?) शो लम्हेश क्लाला प्रकार्गा प्रेस (१८)वाहा?, गीददेहार अने भोपरायट?) शो लम्हेश क्लाला प्रेस (१८)वाहा?, गीददेहार अने भोपरायट?) शो लम्हेश का ब्रिय्हाला प्रेस (१८) शो स्त्री कल्ला प्रवाला मुद्र (२ वाहा?, गीददेहार अने भोपरायट?) शाणा : शाहिलाग (४-छोती) मिल्डतनुं वर्धन : श्री मनोहेह्ता पे पाराम हत् भंजलमुर्ति देसीडेन्सी तरी स्वाहा (भागि महा?) शाणा : शाहिलाग (४-छोती) 3 भी मनोहरलाव प्रयाता हर्द्य (१८वहार अने गीददेहा?) शाणा : शाहिर (४-छोती) मिल्डतनुं वर्धन : श्री मनोहेहला प्रेश (१८वहार अने गीददेहा?) शाणा : शाहिर (४-छोती) मिल्डतनुं वर्धन : श्री संव्याया एवर्य (मुल अने जित्दो अस्ट जु. जुल्दा राल्य (१८वहार अने गीददेहा?) शाणा : आधापर (४-छोती) मिल्डतनुं वर्धन : श्री संवयाह थ्यो (मुल अने जित्दो हु झ्छ, जुल्या राल्य (१८वहार अने गीददेहा?) शाणा : आधापर (४-छोती) स	મેમ c ((s) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ વા ગોહીલના નામે સ્હેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો ાજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમા: ઉત્તર: . વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દોકે જાણીતી સ્કીમમાં ન વહેયા કોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશ- હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર: પ્લો રજીના નામે સ્હેલ રેસીડેન્સીચ ઇનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસલાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬. સોકે તિવાલ અદેસરા ના નામે સ્હેલ ય ખાતે આવેલ ફી હોલ્ડ રેસીડે s કળવો j વર્ધન : શ્રી લાખજી આસુજી બ ધકામ ક્ષેત્રફળ ૭૯. ૩૫ ચો. મી.)) જુનો સર્વે નં. 9૭૮, ૭૮૩, ૭૩, ૭	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm તે સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ગ્રેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ્ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેગફળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેગફળ અંદાજીત ૧૫૨.૬૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ: ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ થટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૧ે માળ, ાચેલ ફિસ્સો ક્ષેગ્રફળ ૩૪ ચો.મી., રેવન્ચુ સર્વે નં.૧૫૪ પૈક્ ના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તેટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્કીમનો રોડ, પુર્વ થવ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેગ્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩ સર્વે નં.૫૮૨/૩), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફીફોલ્ડ રેસીડેન્સીચલ કેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની આરોટના નામે સ્ટેલ હાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિચા ક્ષેગ્રેટ કલ્ડ , કલ્પ, કલ્ડ, કલ્ટ અને ૮૧૩) ક્ષેગ્રેલ્ડ અંદાજાત સ પુજરાત રાજ્ય ખાતે આવેલ રેસીડેન્સીચલ મિલકતના તમ	ec) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટૂક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન શે.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) નામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ લેગ્નફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર અમદાવાદ, ગુજરાત ર યાવેટ નં.૩ પૈકી, પશ્ચિમ લે ચો.મી. લેમજ જમીનન્ ચો.મી. લેમજ જમીનન્ વગર, જમીન લેમઝકળ ધરાવત વગર, જમીન લેમઝકળ દ ચતુ:સીમા: ઉત્તર: પ્લોટ	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co iaiaiana i aiaiana ao i aiaiana i aiaia i aiaiana i aiaiana i aiaia i aiai i ai i ai ai ai ai ai ai ai ai ai ai ai ai ai a	૮, ફેક્સ: (૦૯૯)).in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક, સિક્સ આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ શે બાયેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ સેત્રકળ અંદાત્ રા સાથેલા સ્ટેલ્સા સેત્રક બાયેલ સે પ્રેલ્સ સે સ્ટેલ્સી વાદ, ગુજરાત રાજ્ય ખ ન્સે. સાંકેલિક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો ગેલ મુજબ ૧૪.૬૫ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન રા સાથેલાક કબજો લેસ્સો સેત્રકળ ૧૮.૬૦ ક હા જમીનમાં મોજે: વટવા લક્સ્તાની ચતુ:સીમા : ઉત્ત મને તેના પરનું બાંધકામ : સબ પ્લોટ નં. ૩૩- છ, પુ જમીનમાં ન વઢેશાચેલ હિ i. ૩૮૫ પૈકી ૪ (પ્લોક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન	રેજ 3 લે કરે કે મને એનફોર થોર્ડ કેડિટરના અ સ્કચામતો છેડાવ પ્રાત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો આવેલ સ્થાવ તો સાંધા સ્ક્રો મિલકતના તમામ કબ્લે ધો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્કોઇ દર કોમન ગાર્ડન , માધાપર, તાલુક દ્ર : અંદરનો રોડ ડેસ્સો અને સવલત .૩૮૫ થી ૩૯૨ અને સવ	અચલિત મિલકતોના વે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિક્ત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘક્ત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાચદાના સેક્શન વ સુરક્ષિત બાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાઢ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જ્સ અને અન્ચ ખચીઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાઢ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જ્સ અને અન્ચ ખચીઓ. Rs. 9,94,448/- તા. ૨૬.૦૧૯.૨૦૧૯ની ડિમાઢ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ચ ખચીઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૨.૨૦૧૯ની ડિમાઢ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ચ ખચીઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૨.૨૦૧૯ની ડિમાઢ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જી અને અન્ચ ખચીઓ.	<mark>રાણ માર્</mark> ર, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે તે ગ્રા રાબ-સેક્શન રિઝર્વ કિંમત શ. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/-	દે (જુઓ રૂલ તં. જ ડળ સ્થાવર મિલકતોના દે લે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરળદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દેષક કુમાર, શેક મેને મો.: 9409602726 હા-મેલ : zoahmecovery@india zoahmedabad@indianbaa શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 હા-મેલ : zoahmecovery@india zoahmedabad@indianbaa શ્રી દેવાલાલ ભેરવા, શીફ મેને મો.: 8968370384 હા-મેલ : zoahmecovery@india zoahmedabad@indianbaa શ્રી સ્વજ્ય સુમાર સિંઘ, શીફ મેને મો.: 9458218596 હા-મેલ : zoahmecovery@india zoahmedabad@indianbaa	C (S)) Aluer माटे मारे नीचे आपेत मां आवे छे." तो माटे संपर्भ तेक्ष्र nbank.co.in, nk.co.in मेनेक्ष्र nbank.co.in, nk.co.in nbank.co.in, nk.co.in मेनेक्ष्र nbank.co.in, ik.co.in		
क्रि इलाहाबाट ALLAHABAD ALLAHABAD RESULTION ALLAHABAD Provide State State State State Provide State State State State Provide State State State State ALLAHABAD Provide State State State State Provide State State State State Provide State State State State ALLAHABAD Provide State State State State State Provide State State State State State Provide State S	મેમ c (\$) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે - ની થતી સ્કમની વસૂવાત માટે વ લ ગોઢીલના નામે સ્ટેલ ટેનામે s ફ્લોર + એમસી મુજબ પહેલો બે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચતુ:સીમાં ઉત્તર: વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ ટીકે ભણીતી સ્કીમમાં ન વહેયા છોતા સી જગદીશભાઇ ઇશ્વ ટીકે ભણીતી સ્કીમમાં ન વહેયા છાત પ્લો સ્કીમ : ઉત્તર: પ્લો દેસ્સા. ચતુ:સીમાં: ઉત્તર: પ્લો શ્વર્ધન : શ્રી લાબજી અશ્વ વ્યત્વો અમદાવાદ ૧૧ (અશ્લાવ શ્વિમ : ફલેટ નં .રી-૩૦૬, સોકે તિવાલ અદેસરા ના નામે સ્ટેલ થ્વાન પ્લો ટનં. ૨૮/૧ (અસ્લા શ્વિમ : ફલેટ નં .રી-૩૦૬, સોકે ક ક્વબ્લે j વર્ધન : શ્રી લાબજી આશુજી બ હકામ ક્ષેત્રફળ ૭૯.૩૫ રો.મે.) જુનો સર્વે નં. ૭૭૮, ૭૮૩, ૭૮૩, શ્વ .૮૯, પશ્વિમ: હાઉસ નં.૮૭. સાંક	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm તે સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે f લે ગ્રેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ્ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેગફળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેગફળ અંદાજીત ૧૫૨.૬૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં.૧-એ, દક્ષિણ: ટેનામેન્ટ નં.૫-બી, પુર્વ : ટેન્ થટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૧ે માળ, ાચેલ ફિસ્સો ક્ષેગ્રફળ ૩૪ ચો.મી., રેવન્ચુ સર્વે નં.૧૫૪ પૈક્ ના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તેટ નં.૨પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્કીમનો રોડ, પુર્વ થવ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેગ્રફળ બિલ્ટ અપ એરિયા ૫૧.૩ સર્વે નં.૫૮૨/૩), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફીફોલ્ડ રેસીડેન્સીચલ કેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની આરોટના નામે સ્ટેલ હાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિચા ક્ષેગ્રેટ કલ્ડ , કલ્પ, કલ્ડ, કલ્ટ અને ૮૧૩) ક્ષેગ્રેલ્ડ અંદાજાત સ પુજરાત રાજ્ય ખાતે આવેલ રેસીડેન્સીચલ મિલકતના તમ	pe) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/ચાર્જ રાખેલ છે જે થ્યાવર મિલકતવું ટૂંકમાં નું વિગતવાર વર્ણત ગામેવ્ટ નં.૧૦૨એ, પશ્ચિમ આમદાવાદ- ૭ (ઓટવ) ગામેન્ટ નં.૧૦૨એ, પશ્ચિમ સેગ્નફળ ૩૭ રો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર : પ્લોટ નં.૩ પૈકી, પશ્ચિમ લ રો.મી. તેમજ જમીનન રો.મી. સેગ્નફળ ધરાવત્ રા મી. સેગ્નફળ કા સ્ટ્રા સેગ્ફા માં સેગ્ફા સેગ્નમાં રા માં સા	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co તેને સાંચેતિક કળ તેને સાંકેતિક કળ તેને સાંકેતિક કળ તેને સાંકેતિક કળ તેને સાંકેતિક કળ તેને સાંકેતિક કળ ગ થા ગ સાંકેતિક કળ ગ થા ગ સાંકેતિક કળ ગ થા ગ સાંકેતિક કળ ગ સાંકેતા સાંકેત ર કોમન પ્લોટની ગ ર કા સાંકે સાંકે શ્લાર ગ સાંકે સાંકે સાંકે શ ર કોમન પ્લોટની ગ ર કા સાંકે સાંકે સાંકે શ ર સાંકે સાંકે સાંકે શ ર સાંકે સ	દ, ફેક્સ: (૦૭૯)).in જેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિયન બેંક , સિક આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ અંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર ચ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર ચ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર ચ ગાંધકા ક્ષેત્ર કબ્બે નચે . સાંકેતિક કબ્લે શક્યાયલ અઠ ક્રયા છે. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮. દ્વ સ્ક્રીમાં સેત્રફળ ૧૮. દ્વ સ્ક્રીમાં સેત્રફળ ૧૮. દ્વ સ્ક્રીમાં સેત્રફળ ૧૮. દ્વ સ્ક્રીમાં સેત્રફળ ૧૮. દ્વ સ્ક્રીમાં સેટ્સ સ્ટ્રીય્લે ક્ય ક્રેન્ટસ્ક્રોય, સ્ટ્રાય્ટ્રેશન કો-દસ્ક્રોય, સ્ટ્રાય્ટ્રેશન કો-દસ્ક્રોય, સ્ટ્રાય્ટ્રેશન સ્ટ્રિયાં ન	રે હ ઝ ૩ ૯ ૬ ૬ ૮ , મને એનફોર મોર્ડ ક્રેડિટરના અ સ્કચામતો છેડાવ પ્રત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીગ તા ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્ક્રીગ તો આવેલ સ્થાવ , ગેતેમજ શિરોમર્શ તે આવેલ સ્થાવ , ગેતેમજ શિરોમર્શ ને સ્ક્રો અને સાવ તુ ર અંદર અંદ રેસ્ટ્રી અને સવલત .૩૮૫ થી ૩૯૨ અંદ રેસ્ટ્રી અને સવલત .૩૮૫ થી ૩૯૨ અંદ	અરસલિત મિલકતોના લે મેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘફિત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘફિત આદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘફિત આદિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘફિત બાકી સ્ક્રમ ૨ Rs. 39,22,036/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની કિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. ٢ Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૮ની કિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. ٢ Rs. 9,94,448/- તા. ૨૪.૦૫.૨૦૧૮ની કિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ , ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની કિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ , ચાર્જીસ અને અન્થ ખરાઓ. Rs 5115023/- તા. ૨૯.૦૮.૨૦૧૦૮ની કિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ ન સે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ ન સે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ ન સે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ ન સે તારીખ સુધીનુ	<mark>રાણ માર્</mark> ર, ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'જે છે તે ગ્રા રાબ-સેક્શન રિઝર્વ કિંમત શ. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/-	દે (જુસ્મો રૂલ તાં. જ કળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું દયાન દોરવ ચારતો અને નિચમોની વધુ વિગત શ્રી દિપક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દ્ય-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દ્ય-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી ટેવાલાલ તેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દ્ય-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી અત્રચદ્વમાર, ચીફ મેને મો.: 9833775798 દ્ય-મેલ : zoahmrecovery@indian zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દ્ય-મેલ : zoahmrecovery@indian	८ (୨)) विद्यास माहे गरे नीये आपे(ाम आवे छे." तो माहे संपर्झ तेक्व nbank.co.in, nk.co.in मेनेक्व nbank.co.in, nk.co.in nbank.co.in, nk.co.in मेनेक्व nbank.co.in, ik.co.in		
क्रि इलाहाबाट ALLAHABAD ALLAHABAD RESULTION ALLAHABAD Provide State (Some State Colspan="2">Provide State Colspan="2" Provide State Colspan= Provide State Colspan="2"	મેમ c (\$) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ ના થતી સ્કમની વસૂલાત માટે બ ક ગોઢીલના નામે સ્ટેલ ટેનામે ક સ્વોર + એમસી મુજબ પહેલો ાંજે ગામ - રખિચાલ, તાલુકો- .મિલકતની ચલુ:સીમાં ઉત્તર: . વર્ધન : શ્રી જગદીશ(ભાઇ ઇશ્વ દીકે જાણીતી સ્કીમમાં ન વહેવા છાનલ પ્લો ટ્સીમાં ઉત્તર: પ્લો દિસ્સા. ચતુ:સીમાં ઉત્તર: પ્લો દિસ્સા. ચતુ:સીમાં ઉત્તર: પ્લો છાનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસવા સિમ : ફ્લેટ નં. સી-૩૦૬. સોકે તિવાલ અદેસરા ના નામે સ્ટેલ થ ખાતે આવેલ ફ્રી ઢોલ્ડ સેસીડે ક કબજો j વર્ધન : શ્રી લાખજી આસુજી બ દાકામ ક્ષેત્રફળ ૭૯. ગ્રપ્ર ચો. મી. ગ ગમદાવાદ -૧૨ (નિકોલ), ગુ .૮૯, પશ્ચિમ: હાઉસ નં.૮૭. સાંક	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: ZO.ahm તે સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને ગેયે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે વિ તે ગેયે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે વિ તે ગેયા થશે. રિઝર્ડ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ્ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રક્ળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૬૬ ચો.મી) એમન્બ્રુઆલ ક્ -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ -ગણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ સ્ટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮ , ૩જો માળ, માથેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., રેવન્યુ સર્વે નં. ૧૫૪ પે માં સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) અને જિલ્લો મોટ નં.૨ પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફ્રીકોલ્ડ રેસીડેન્શીચલ કેલ્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની બારોટટના નામે સ્ટેલ હાઉસ નં.ઈ-૮૮, પ્લોટ એસ્ટિયા દ્વીમોટેડ કલ્ડ, ૭૯૫, ૭૯૬, ૭૯૮ અને ૮૧૩) ક્ષેત્રફળ અંદાજીત સ્ પુંચ્ટાત રાજ્ય ખાતે આવેલ રેસીડેન્સીચલ મિલકતના તમ કોરાન કારબ્યો વેગતો, જેની બેકને કંઇ ખબર હોચ- આધિકૃત	pe) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/શાર્જ શખેલ છે જે શ્વાવ મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન ો.ચાર્ડ એટલે કે ૭૧.૦૭ તે.ઓપ.હઉસીંગ સોસા, અમદાવાદ. ૭ (ઓઢવ) ત્રાપ્રેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ સેત્રફળ ૩૭ ચો.મી. (એ કી, ઢિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ :પ્લોટ નં.૩ પૈકી, પશ્ચિમ લ્ ચો.મી. લેમજ જમીનન્ યો.મી. લેમજ જમીનન ચો.મી. લેમજ જમીનન વગર, જમીન ક્ષેત્રફળ દ ચતુ:સીમા: ઉત્તર: પ્લોટ ફળ ૯૬.૯૮ ચો.મી. તેમબ તરીકે ભાશીતી સ્કીમમાં ગ્રષ્ઠ ચો.મી. મોજે- કઠ મામ ભાગ અને ઢિસ્સા. સ્	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co nhe દ્વાચનાનિ જેનો સાંકેતિક કબ ાં વર્ણન પણ નીચે : ગ સાંકેતિક કબ ાં વર્ણન પણ નીચે : ગ સાંકે તેને કબ ગ સાંકે તેને કબ મ સાંકેના મેન્ટ નં .c- પ્રેએમસી ટેક્સ બી ન પ્લાનિંગ નં .(નિ સ્પ્ય ખાતે આવેલ મ ટાઉન પ્લાનિંગ ન ન વહેચાચેલ નિ તિ બિન ખેતીલાચ ગ અને હિસ્સા. મિ- ૪૯ .ce ગ્ર ચો.મી. અ ટ નં . ૩૨, દક્ષિણ: જ કોમન પ્લોટની વ ડવાડા સીમ, તાલુક્ ચતુ:સીમા: ઉત્તર સ બાણકારી અને	દ, ફેક્સ: (૦૭૯)).in જેસચલ એસેટ્સ ર ાજે ઇન્ડિચન બેંક , સિક આપેલ છે. "સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ અંદાદ્ શેકે બાશીતી સ્કીમમાં , શ વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો લે સુજબ ૧૪.૬૫ ચો.મી દકીલ-રખિચાલ), झઇન વા સુંદેલક રસીડેન્સીચલ સ્કીમનો રોડ. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮.૬૦ સ્કીમનો રોડ. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮.૬૦ સ્કીમનાં સાંકેત્રક બ્લે સ્કીમને રોડ સ્ક્ષેટ્સાંકામ : સબ પ્લોટ નં. ૩૩-ઇ, પુ જમીનમાં ન વહેચાચેલ દિ i. ૩૮૫ પેકી ૪ (બ્લોક નં ફો-દસ્ક્રીઇ, સ્જ્રસ્ટ્રેશન I : હાઉસ નં.૭૩, દક્ષિણઃ ઝે માહિતી મુજબ નીસ્ટ	રે હેઝ 3 લ્ડિક્ટ ર, મને એનફોર થોર્ડ ક્રેડિટરના અ સ્ટચામતો છોડાવ ગુત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાભિંગ સ્ક્રીમ તે આવેલ સ્થાવર તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવર તો અવેલ સ્થાવર મેલકતના તમાગ કબ્જો થો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્ક્રોઇ થો.મી. શ્રીભે માળ , તાલુકો: દસ્ક્રીઇ થો.મી. શ્રીભે માળ , તાલુકો દસ્ક્રીઇ સ્ટઓ અને સવલત .3૮૫ થી ૩૯૨ અને સ્ટ્રેડ્સ્ટ્રીક્ટ અને સવ ડુંગ્ ફુટ રોડ., પુર્વ વે વર્ષવેલ મિલ	અચલિત મિલકતોના વે મિલ્ટ ઓફ સિકચોરીટી ઇલ્ટરેસ્ટ એક્સ ચિક્ત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે યાની ઉપલબ્દ સમય મર્ચાદા અંગે કાયદાના સેકશન વ સુરક્ષિત બાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૮.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 9,94,448/- તા. ૨૯.૦૧.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 2,0,980/- તા. ૦૯.૦૨.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૨.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૨.૨૦૧૯ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૨.૨૦૧૯ ની ઉમાઠ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્થ ખર્ચાઓ.	રાણ મારે ક. ૨૦૦૨ હેઠ જ્યાં છે', 'બે છે ટે ૩ના સબ-સેક્શન શ્રિઝ્ર્વ કિંમત રેક. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/- Rs.31,76,000/-	દ (જુઓ રૂલ તં. જ કળ સ્થાવર મિલકતોના દ તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ ચારતો અને નિયમોની વધુ વિગત શ્રી દેષક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દ્યં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દ્યં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી દેવાલાલ છેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દ્યં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી સ્વચ્લાય, ચીફ મેને મો.: 9458218596 દ્યં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દ્યં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba	८ (୨)) विद्यास माहे मारे नीचे आपे(मां आवे छे." तो माहे संपर्झ नेकर nbank.co.in, nk.co.in केनेकर nbank.co.in, nk.co.in केनेकर nbank.co.in, nk.co.in केनेकर nbank.co.in, nk.co.in		
Image: Selection of the second seco	મેમ c ((s) ની જોગવાઇઓ ટિસથી જણાવવામાં આવે છે કે બ ની થતી સ્કમની વસૂલાત માટે બ લ ગોઢીલના નામે સ્ઢેલ ટેનામે ક ફ્લોર + એમસી મુજબ પહેલો વિ ગામ - રખિયાલ, તાલુકો- .મિલકતની ચલુ:સીમાં ઉત્તર: . વર્ધાન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દી કે જાણીતી સ્કીમમાં ન વહેવા- કોલ, તાલુકો સીટી , રશ્રસ્ટ્રેશ- દિસ્સા. ચલુ:સીમાં ઉત્તર: પ્લો રજીના નામે સ્ઢેલ રેસીડેન્સીચ ઇનલ પ્લો ટનં. સ્ટ/૧ (જુનો સ જલ્લો અમદાવાદ ૧૧ (અસવાલ શ્વિમ : ફ્લેટ નં. સી-૩૦૬ , સોકે તિલાલ અદેસરા ના નામે સ્ઢેલ ય ખાતે આવેલ ફ્રી હોલ્ડ રેસીડે ક કબાજો i વર્ધન : શ્રી લાખજી આસુજી બ દાકામ ક્ષેત્રફળ ૭૯.૩૫ રો.મે. ગ ગમદાવાદ - ૧૨ (નિકોલ) , ગુ અમદાવાદ - ૧૨ (નિકોલ) , ગુ .૮૯ , પશ્વિમ: હાઉસ નં .૮૭ સાં કરભારથની વિ i તારીખ ઇ-ઢરાજી	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm 1 સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને નેશે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ નેશે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ લેશે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજુત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજુત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજુત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ 	pe) ૨७४३૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/શાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્શન ગે.ચાર્ડ એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હાઉસીંગ સોસાર અમદાવાદ- ૭ (ઓટવ) ત્રાપ્રે એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હાઉસીંગ સોસાર અમદાવાદ- ૭ (ઓટવ) ત્રાપ્રે એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હાઉસીંગ સોસાર અમદાવાદ- ૭ (ઓટવ) ત્રાપ્રે એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હાઉસીંગ સોસાર અમદાવાદ- ૭ (ઓટવ) સ્ત્રે બ્રેડ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર રાપ્રે સ્ટે બ્રેડ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર રાપ્રે સ્ટે બ્રેડ્સા નં.૧, ટાઉન સ્ત્રાર્ટ્સા નં.૧, ટાઉન સ્ત્રાર્ટ્સા બ્રેડ્સા નં.૨, સ્ટે આદાકારીના સેમ્બર્ડ્સા સ્ટ્ર આદાકારીના સેમ્બર્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સ પ્રેન્ડ્સા સ્ટ્ર આદાકારીના સેપ્રેન્ડ્સ પ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સ્ટ્ર પ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડ્સ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડસ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડસ સ્ટ્ર સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડસ સ્ટ્ર આદાકારી સેપ્રેન્ડસ સ્ટ્ર આદાકારી સેપ્ર સ્ટ્ર સ્ટ્ર સ્ટ્ર સ્ટ્ર સ્ટ્ર આદાકારી સેપ્રેન્સ સ્ટ્ર સ્ટ સ્ટ્ર સ્ટ્ર સ્ટ્ર સ્ટ્ર સ્ટ્	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co ianbank.co ii ais a so ii a	દ, ફેક્સ: (૦૭૯) D.in જેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિચન બેંક, સિક આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ અંદાણ શેકે બાણીતી સ્ક્રીમમાં, દા વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો વિ મુજબ ૧૪.૬૫ ચો.મી ાકોલ-રખિચાલ), ફાઇન વા ફીમેલા રેડી. સાંકેતિક ક્લિસ્તો ક્ષેત્રફળ ૧૮.૬૦ ર સ્ક્રીમના રોડ. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮.૬૦ ર સ્ક્રીમના રોડ. સાંકેતિક હેસ્સે સ્વેત્રફળ ૧૮.૬૦ ર સ્ક્રીન્સ્ક્રોય ટ્સ્ટ્રિયેટ ગ્લેટ્સ ક્લે ક્સે સ્ટ્રિક્સ્ક્રોય વ્યક્સ ક્લે ક્લે ક્લે ક્લે ક્લે ક્લે ક્લે ક્લે	રે બેઝ 3 લે કે કે ડે ટરના અ સે કે કે ડે ટરના અ સ્કચામતો છે ડાવ ગુત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાભિંગ સ્કીગ તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવર તો આવેલ સ્થાવર તો અવેલ સ્થાવર ગે તે મજ શિરોમાં મિલકતના તમાગ કબજો થો.મી. ત્રીજો માળ પ્ર તાલુકો: દરકોઇ વ્ય સ્ટે સ્ટે કે અને સવલત .3.૮૫ થી ૩.૨૨ અને રે સ્ટ્રીક્ટ અને સવલત .3.૮૫ થી ૩.૨૨ અને રે સ્ટ્રીક્ટ અને સવ ડે સ્ટ્રીક્ટ અને સવ ટે ત્યુટિક અને સવ ટે ત્યુટીક્ટ અને સવ સ્ટ્રીકટ અને સવ ટે ત્યુટીકટ અને સવ ટે સ્ટ્રીકટ અને સવ ટે ત્યુટીક સ્ટે અને સવ ટે ત્યુટીકટ અને સવ ટે ત્યુટીક સ્ટે અને સવ ટે ત્યુટીક સ્ટે અને સ્ટે સ્ટ્રીકટ અને સવ ટે ત્યુટીક સ્ટે અને સ્ટે સ્ટ્રીકટ અને સ્ટે સ્ટ્રીક સ્ટે અને સ્ટે સ્ટ્રીક સ્ટે અને સ્ટે સ્ટ્રીક સ્ટે અને સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટ	અચલિત મિલકતોના લે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે યાની ઉપલબ્ધ સમય મર્યાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત બાકી રકમ	રાણ મારે સ્ ૨૦૦૨ હેઠ બ્યાં છે', 'બે છે તે ૩ના સબ-સેક્શન સ્ઝિ કિંમત સ્ડ. 57,92,000/- સ્ડ.12,29,000/- સ્ડ.12,29,000/- સ્ડ.131,76,000/- સ્ડ.31,76,000/- લે) http://ww	દે (જુઓ રૂલ તાં. જ કળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું દ્યાન દોરવ ચારતો અને નિયમોની વધુ વિગત શ્રી દેપક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી દેવાલા તેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી અભ્યકુમાર, ચીફ મેને મો.: 985218596 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india	८ (୨)) Aurent Hight II हे नी से आपेत II हे नी से आपेत II Hight Rest Area Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in		
હે દ્વાદાવા ALLAHABAD દ્વાદરા સાંદ્ર સ્વાત્રો સાંદ્ર સ્વાત્રો સાંદ્ર સ્વાત્રો સાંદ્ર સાંદ	૨૮ (୨) ની જોગવાઇઓ ટેસથી જણાવવામાં આવે છે કે બ ની થવી સ્કમની વસૂલાવ માટે વ લ ગોઢીલના નામે સ્ઢેલ ટેનામે લ ગોઢીલના નામે સ્ઢેલ ટેનામે ક ડ્વોર + એમસી મુજબ પહેલો ભેગ ગામ - રખિચાલ, તાલુકો- ામ - રખિચાલ, તાલુકો- ામેલકતની ચલુ:સીમાં ઉત્તર: વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીકે ભણીતી સ્કીમમાં ન વઢેવા દોલ ના સ્ક્રી જગદીશભાઇ ઇશ્વ દીકે ભણીતી સ્કીમમાં ન વઢેવા દોલ ના સ્ક્રી સ્કર્ગ સ્ટે સ્ટે સ્ટે સ્ટે કેન્સી કરે જો છે તે છે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટ	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: ZO.ahm 1 સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને ને તે વાયેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાસે વિ લે વેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને સ્ મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રક્ળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રકળ અંદાજીત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ મ્-મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં. ૧-એ, દક્ષિણ ટેનામેન્ટ નં.પ-બી, પુર્વ : ટેન્ ઘટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૬ માળ, પ્રાચેલ ફિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., રેવન્યુ સર્વે નં. ૧૫૪ પૈક્ ાથેલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રક્ળ બિલ્ટ આ એરિયા ૫૧.૩ થવ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રક્ળ બિલ્ટ આ એરિયા ૫૧.3 લવે નં. પ૮૨/૩), ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફ્રીઠોલ્ડ રેસીડેન્સીચલ કેલ્સીચલ ઠાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની બારોટના નામે સ્ટેલ ઠાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિચા ક્ષેત્ર ડેન્સીચલ ઠાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની બારોટના નામે સ્ટેલ ઠાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિચા ફ્ષેત્ર કેલ્સીચલ ઠાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની બારોટના નામે સ્ટેલ ઠાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિચા ફ્ષેત્ર ડેન્સીચલ ઠાઉસના તમામ ભાગ અને હિસ્તા. મિલકતની બારોટના કાબ્ય ખાતે આવેલ રેસીડેન્સીચલ મિલકતના તમ કેલ્તિક કબ્લે વેગતો, જેની બેક્તે કંઇ ખબર દ્વોચ- આધિકૃત સ્ માટે અગત્ટની નૉધ: બ્રીડરોએ નીચેની ઑપચારિ	pe) ૨७४३૫୨୨३, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/ચાર્જ રાખેલ છે જે થ્યાવર મિલકતવું ટૂંકમાં નું વિગતવાર વર્ણત ગે.ચોપ હાઉસીંગ સોસાર અમદાવાદ- ૭ (ઓટવ) ગામેન્ટ નં.૧૦-એ, પશ્ચિમ સેગ્નફળ ૩૭ રો.મી. (એ કી, હિસ્સા નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ર : પ્લોટ નં.૧ પેકી, પશ્ચિમ અમદાવાદ, ગુજરાત ર : પ્લોટ નં.૩ પેકી, પશ્ચિમ અમદાવાદ, ગુજરાત ર : પ્લોટ નં.૩ પેકી, પશ્ચિમ લ્ રો.મી. તેમજ જમીનન રો.મી. તેમજ જમીનન રો.મી. સેગ્નફળ ધરાવત્ રા મી.સેગ્નફળ ધરાવત્ રા મી.સેગ્નફળ ધરાવત્ રા મી.સેગ્નફળ ધરાવત્ રા મી. સેગ્નફળ ધરાવત્ સ્વાર્ગ વહેલી તકે પૂ bapi/) પર પોતાનો પોવાઇટર દ્વારા વેરિફન	, ૨૭૪ ૩૧ ૨૪૮ anbank.co nbank.	દ, ફેક્સ: (૦૭૯)).in જેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિયન બેંક, સિક આપેલ છે. 'સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ અંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ બંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકા ક્ષેત્રફળ વડ.દ્ ર સ્વીનમાં સેત્રફળ વડ.દ્ ક જમીનમાં મોબે: વટવા લક્સ્તની ચતુ:સીમા : ઉત્ત ક્ષેત્રે સેત્રફળ વડ.દ્ ર સ્વીનમાં ન વહેચાચેલ દિ તં. ૩૮૫ પેકી ૪ (૦લોક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન કો માહિતી મુજબ નીચ દાજે ર દિવસ લાગે). '	રે હેઝ 3 લે કે કે ડે ટરના અ સે કે કે ડે ટરના અ સ્કચામતો છે ડાવ પ્રાં કે કે ડિટરના અ સ્કચામતો છે ડાવ પ્રાં કે કે ડે ટરના અ સ્કચામતો છે ડાવ પ્રાં તે આવેલ સ્થાવ તે આવેલ સ્થાવ તે આવેલ સ્થાવ પ્રાં તે આવેલ સ્થાવ કે બ્લે બે બે સ્વાવત પ્રાં કે સ્ટે સ્ટે અને સવલત ડે સ્ટ્રી ટર અને સવલત ડે સ્ટ્રી ટર અને સવલત ડે સ્ટ્રી ટર અને સવલત ડે સ્ટ્રી ટર અને સવલત પ્રં સ્ટે સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે ટર અને સવલત પ્રં સ્ટે સ્ટે ટર અને સ્ટે સ્ટે સ્ટે સ્ટે ટર અને સ્ટે ડે સ્ટે ડે અને સ્ટે સ્ટે સ્ટે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે ડે ડે સ્ટે ડે ડે ડે સ્ટે ડે સ્ટે ડે સ્ટે સ્ટે ડે સ્ટે સ્ટે ડે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટ	अरुदिति मिसङतोजा दे भिन्ट ओई सिड्योरीटी छन्टरेस्ट એक बिङ्व अधिडारी द्वारा वेवामां आव्यो छे એनुं '१ंभछे वानी ઉपतन्द समय मयांदा रांगे डायदाना सेड्यान प सुरक्षित पाडी रङम . Rs. 39,22,036/- ता. २६.०८.२०१०नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . Rs. 13,14,346 /- ता. २६.०९.२०१०नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . Rs. 9,94,448/- ता. २४.०५.२०१८नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . Rs. 9,94,448/- ता. २४.०५.२०१८नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . Rs. 9,94,448/- ता. २४.०५.२०१८नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . Rs. 2,20,980/- ता. ०६.०४.२०१९नी डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . पर्या, यार्श्वर अने अन्व भायाओ. . Rs. 5115023/- ता. २६.०८.२०१०ती डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीખ सुधीनुं व्याप अने . पर्या, यार्श्वर अने अन्व भायाओ. . Rs. 5115023/- ता. २६.०८.२०१०ती डिमान्ड नोटीस मुक्ल + थे ते तारीण सुधीनुं व्याप अने . पर्या, यार्श्वर अने अन्व भायाओ.	રાણ મારે સ્ ૨૦૦૨ હેઠ બ્યાં છે', 'બે છે તે ૩ના સબ-સેક્શન સ્ઝિ કિંમત સ્ડ. 57,92,000/- સ્ડ.12,29,000/- સ્ડ.12,29,000/- સ્ડ.131,76,000/- સ્ડ.31,76,000/- લે) http://ww	દે (જુઓ રૂલ તાં. જ કળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું દ્યાન દોરવ ચારતો અને નિયમોની વધુ વિગત શ્રી દેપક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી દેવાલા તેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી અભ્યકુમાર, ચીફ મેને મો.: 985218596 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india	C (S)) Aller माटे मंदे नीचे आपेल मां आवे छे." तो माटे संपर्झ तो माटे संपर्झ तो माटे संपर्झ तो माटे संपर्झ तो माटे संपर्झ तो क्रिकर nbank.co.in, nk.co.in क्रेकेस्ट nbank.co.in, nk.co.in केलेस्ट nbank.co.in, nk.co.in केलेस्ट nbank.co.in, nk.co.in		
હે इलाहाबाद ALLAHABAD સિક્ટોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ ના નિચમ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને ભામેનદાર/રો, ગીરોદાર/રો આ નીતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને ભામેનદાર/રો, ગીરોદાર/રો આ નીતિ જાહેર જનતાને સામાન્ય રીતે અને કરજદાર/રો અને ભામેનદાર/રો, ગીરોદાર/રો આ નીત જાહેર જનદાર/રો અને ભામેનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિક્ચોર્ડ કેડિટરે લેવાન જાં ઉદ્યારક્તીઓ / ભામેનદાર/ / મોર્ગજરોનું નામ અને શાખાનું નામ ૧ ૧. બાઘર ગોરીલ (પ્રોપરાઘટરશીપ કંપની, દેવાદાર) મિલકતનું વર્ઘત : શ્રી સેમસન પોલ (રેગ્યુલરાઇઝડ પ્રાન મુજબ ગ્રાઉઠક નં.૧, ફાઇનલ પોટ નં. ૧૫, મો) ૧ ٩. બાઘર કંપેરિશ (પ્રોપરાઘટરશીપ (પ્રોગ કલ્યુલાઇ ધ્વરભાઇ પહેલ (દેવાદાર, ગીરદેદાર અને પ્રોપરાઘટર) શ્રી જગદિશભાઇ ઇલગ્રભાઇ પહેલ (દેવાદાર, ગીરદેદાર અને પ્રોપરાઘટર) શ્રી જેલભાઇ પ્રલામાં મહેલ (દેવાદાર, ગીરદેદાર અને પ્રોપરાચટર) શ્રી ભત્રેશ કલુભાઇ પ્રભાધ (દેવાદાર) શ્રી ભત્રેશ કલુભાઇ પ્રભાધ પહેલ (દેવાદાર, ગીરદેદાર અને પ્રોપરાચટર) શ્રી ભત્રેશ કલુભાઇ પ્રવાપતિ (ભામેનદાર) શાખા : શીલીફ રોડ (ઇ-એબી) મિલકતનું વર્ઘત : શ્રી મનોહરલાલ પેપારામ દરઝ (દેવાદાર અને ગીરદ્યદાર) શાખા : શાહિભાગ (ઇ-એબી) ૩ શ્રી સંભ્યાભાઇ જ્વંતિલાલ અદેસરા (શેલારા અને ગીરદ્યદાર) શાખા : શાહિવા ચરીરા (ભામેનદાર) શ્રી દેતેશ પટાકીયા (ભામેનદાર) શ્રી સન્થ બાદી સ્લીલા સ્ટીલ (પ્રોપરાચટરશીપ કંપની-દેવાદાર) શ્રી શન્શભાઇ આસુજા લારોર (દેવાદાર, ગીરદેદાદાર) ગીરોદાદાર) શાખા : શીલીફ રોડ (ઇ-એબી) મિલકતનું તોમલ બાદ ૩૯૯ પેકી?) ડિસ્ટ્રીક્ટ ર હારિશનં. ٧ મેકલી બહાણા સ્ટીલ (પ્રોપ?!! ૨૦% રીડર્ડ ઉક્તાના! મિલકતનું લોક્ટ રો તો. ડા રહે (રેક્ટ) હારે! તો. ડિસ્ટ્રીક્ટ રા તો ડિપોઝીટ! ૧૦% રીઝર્ડ ઉક્તા સા રોબ તા કાર છાવ	૨ (\$) નी જોગવાઇઓ ટેસથી જણાવવામાં આવે છે કે બ ની થવી સ્કમની વસૂલાવ માટે વ લ ગોઢીલના નામે સ્ઢેલ ટેનામે ૬ રુલોર + એમસી મુજબ પહેલો ાષે - રખિયાલ, તાલુકો- ગમદાવાદ નથ (તાલુકો- . મિલકતની ચલુ:સીમા: ઉત્તર: વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીકે ભણીતી સ્કીમમાં ન વહેવા- દીસ બાણી સ્કીમમાં છત્તર: પો શ્વર્ધન : શ્રી જગદીશભાઇ ઇશ્વ દીસ બાણે સાટે તે સ્ટ/૧ (જુનો સ જલ્લો અમદાવાદ ૧૧ (અસવાદ શ્વિધા અદેસરા ના નામે સ્ટેલ ય ખાતે આવેલ ફી હોલ્ડ રેસીકે નં કબાબો દાવર્ધન : શ્રી લાખજી આસુજી બ દાકામ ક્ષેત્રફળ ૭૯.૩૫ રો	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Z0.ahm 1 સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ લીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ ક્રેડિટર પાસે વિ તે તે પાય થશે . રિઝર્વ કિંમત , અર્નેસ્ટ મની ડિપોઝીટ અને જે મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રક્ળ અંદાજીત ૮૫ ચં તે માળ ક્ષેત્રફળ અંદાજુત ૧૫૨.૬દ્ ચો.મી) એમબ્યુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ : ટેનામેન્ટ નં .૧-એ, દક્ષિણ ટેનામેન્ટ નં .૫-બી, પુર્વ : ટેન્ ઘટભાઇ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૧ માળ, માંચેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૪ ચો.મી., દેવન્યુ સર્વે નં .૧૫૪ પૈક નન સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) અને જિલ્લો મોટ નં .૨ પેકી, દક્ષિણ ટાઉન પ્લાનિંગ સ્કીમનો રોડ, પુર્વ થલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ આ એરિયા ૫૧ .3 મર્વે નં .૫૨૮/૩), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં .૮૦ ની ૩૧૦૯ લી), ગુજરાત રાજ્યા ખાતે આવેલ ફ્રીઢોલ્ડ દેસીડેન્સીચલ કેલ્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની આરોટના નામે સ્ટેલ હાઉસ નં .ઈ-૮૮, પ્લોટ એસ્ટિયા લેમ્સ ડેન્ટ્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની આરોટના નામે સ્ટેલ હાઉસ નં .ઈ-૮૮, પ્લોટ એસ્ટિયા લેમ્લક ડેન્ટ્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની વારોટલ કબ્લો વેગતો, જેની બેંક્તે કંઈ ખબર હોચ- અધિકૃત વ માટે અગત્થની નોંધ: બીડરોએ નીચેની ઓપચાર્સિ M.mstceecommerce.com/auctionhome/ બાન રહેશે. કેવાચસી દસ્તાવેજોને ઈ-હરાજી સર્વિસ્ટ	ec) ૨૭૪૩૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેરવે/રાર્જ રાખેલ છે જે શ્યાવર મિલકતનું ટૂંકમાં નું વિગતવાર વર્ષન શે.આપ.હાઉસીંગ સોસા અમદાવાદ- ૭ (ઓઢવ) ત્રાર્ડ એટલે કે ૭૧.૦૭ કો.ઓપ.હાઉસીંગ સોસા અમદાવાદ, ગુજરાત ૨ સંસ્વેઝફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં. ૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ સંસ્વેઝફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં. ૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ સંસેઝફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં. ૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ સંસેઝફળ ૩૭ ચો.મી. (એ કી, હિસ્સા નં. ૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ સંસેઝફળ ૩૭ ચો.મી. (એ ક્રેગ ૯૬, ૮૮ ચો.મી. તેમબ તરીકે બાણીતી સ્ક્રીમમાં દ્વરા સ્વીમાં: ઉત્તર: પ્લોટ આધિકારીની શ્રેષ્ઠતમ કતાઓ વહેલી તકે પૂ bapi/) પર પોતાનો મોવાઇડર હારા વેર્ફિફ	, ૨૭૪ ૩૧૨૪૮ anbank.co ianbank.co ia aishas so ii alishas so ii alishas so ii alishas so ii alishas so ii alishas so ii alishas an alishas an a	દ, ફેક્સ: (૦૯૯)).in જેસચલ એસેટ્સ ર ાજો ઈન્ડિયન બેંક, સિક્ આપેલ છે. "સિક્ચોર્ડ અ માંધકામ ક્ષેત્રફળ અંદાત્ શે બાયીતી સ્કીમમાં, ટા વાદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો લે મુજબ ૧૪.દ્ધ ચો.મી કોલ-રખિયાલ), ફાઇન સ્કીબનો રોડ. સાંકેતિક ક્લીમનો રોડ. સાંકેતિક ક્લીમનો રોડ. સાંકેતિક લેસ્સો ક્ષેત્રેફળ ૧૮.દ્વ સ્કીમનો રોડ. સાંકેતિક ક્લીમનો સ્ટ્રાયોલ ક્લીમાં સ્ટેસ્સે બ્લીક નં. ડાટ્ય બમીનમાં ન વહેચાચેલ દિ i. ૩૮૫ પૈકી ૪ (બ્લીક નં કો-દસ્કોઇ, રજીસ્ટ્રેશન : હાઉસ નં.૭૩, દક્ષિણ કો માહિતી મુજબ ની દેશે: પગલું ૧લું : બીક્ દારે રે દિવસ લાગે). : વારીખ સુધીમાં કે તે I	રે હેઝ 3 લે કે કે ડે ટરના અ સર્કચામતો છે ડાવ કે કે ડિટરના અ સ્કચામતો છે ડાવ ગત ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીમ તો આવેલ સ્થાવર .) તેમજ શિરોમણં તે બાવેલ સ્થાવર .) તેમજ શિરોમણં તે બાવેલ સ્થાવર કે બ્લો ટ નં.૩, મોર્વ બિલકતના તમામ કે બ્લો બિલકતના તમામ કે બ્લો બિલકતના તમામ કે બ્લો બિલકતના તમામ કે બ્લો બિલકતના તમામ કે બ્લો બેલક સ્ટે બેલ કે સ્ટે બેલ્ સ્ટે બેલ કે સ્ટે ડે અને સવલત .૩૮૫ થી ૩૯૨ અને સે સ્ટે બેલે સ્વાય કે સ્ટે બેલે સ્વાય કે સ્ટે બેલે સ્વાય કે બેલે સ્ટ અને સવલત .૩૮૫ થી ૩૯૨ અને સે સ્ટે બેલે સ્ટ અને સે સ્ટે બેલે સ્ટ અને સે સ્ટે બેલે સ્ટ અને સવલત .૩૮૫ થી ૩૯૨ અને સે સ્ટે બેલે સ્ટ અને સવ બેલ સ્ટ બેલે સ્ટ અને સવ સે સ્ટ બેલે સ્ટ અને સ્ટ અને સવ સે સ્ટ બેલે સ્ટ અને	અરસલિત મિલકતોના લે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિક્ત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે વાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ Rs. 39,22,036/- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 13,14,346 /- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 9,94,448/- તા. ૨૯.૦૯.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 2,20,980/- તા. ૦૯.૦૪.૨૦૧૯ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૯.૨૦૧૨૦૧ ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૯.૨૦૧૨૦૧ ડીમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 5115023/- તા. ૨૯.૦૯.૨૦૧૨૦૧ તી ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખયાઓ. Rs. 115023/- તા. ૨૯.૨૦૧૨૦૧ તી ડિમાન્ડ નોટીઓ સ્ટા વાજો અને ખર્ચા, ચાર્જીસ અને અન્ય ખરાઓ. તા ૨૬ કોઈ કરભારણ નથી.	રાણ માતે ક, ૨૦૦૨ હેઠ બ્યાં છે', 'બે છે ટે ૩ના સબ-સેક્શન શ્રિત્ર કિંમત ક. 57,92,000/- Rs.14,00,000/- Rs.12,29,000/- Rs.697000/- Rs.697000/- Rs.31,76,000/- સ્ક.31,76,000/- એ) http://ww કેવાચસી વેસિક્	દે (જુઓ રૂલ તાં. જ કળ સ્થાવર મિલકતોના દે તે છે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું દ્યાન દોરવ ચારતો અને નિયમોની વધુ વિગત શ્રી દેપક કુમાર, ચીફ મેને મો.: 9409602726 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી દેવાલા તેસ્વા, ચીફ મેને મો.: 8968370384 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianba શ્રી અભ્યકુમાર, ચીફ મેને મો.: 985218596 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianban શ્રી રાજેશ કુમાર સિંઘ, ચીફ મો.: 9833775798 દી-મેલ : zoahmrecovery@india	C (S)) Azıltı माटे II दे नी ये आपेल II ये नी ये आपेल III आटे रांपर्ड तो माटे रांपर्ड तो माटे रांपर्ड तो या रांपर तो माटे रांपर तो माट रांपर तो माटे रांपर ता माटे रांपर तो माटे रांपर तो माटे रांपर तो माटे रांपर तो माटे रांपर ता माट रांपर ता माटे रांपर ता माटे रांपर ता माटे रांपर ता माटे रांपर ता माटे रांपर ता माट रांपर ता माटे रांपर ता माटे रांपर ता माटे रांपर ता माट रांपर		
હે इलाहाबाद ALLAHABAD જાહેર જવાતાંગે સામાગ્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ ગોતિ તારીખે જે તે કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ ગોતિ જાહેર જવાતાંગે સામાગ્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ ગોતિ ભિલકતાં વાર્ચા અને શાખાલું નામ જાહેર જવાતાંગે સામાગ્ય રીતે અને કરજદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આરેલે કિડેટરે વેવાન ભિલકતાં વાર્ચા અને શાખાલું નામ જાહે કરજદાર/રો અને જામીનદાર/ મોર્ગજરોવું નામ અને શાખાવું નામ જા બાદ કો ગીરેદાર? ભિલકતાં વાર્ચા અને શાખાવું નામ શ. બાદ કો ગીરેદાર? ભિલકતાં વાર્ચા અને શાખાવું નામ શ. બાદ કા ગી રો ગોરીલ () પોપરાચરર, જામીનદાર અને ગીરેદોર? ભિલકતાં વાર્ચા અને શાખા છે તે લગ્ન શાબા છે તે લાગ છે તે લગ્ન શાબા છે તે લગ્ન શાબા છે તે લગ્ન શાબા છે તે લગ્ન શાબા છે તે લા ગીરેદાર અને પોપરાચરર, જા ગી લગા છે તે બાદા છે તે ગીરેદાર છે તે ગી ગોર શાળ છે તે લા છે તે લગ્ન શાબા છે તે લા છે તે લગ્ન શાબા છે તે લા શાબા છે તે લા શાબા છે તે લા છે લગે ગોર હેદાર છે તે ગીરેદાર છે તે શાબા છે સાધા છે લા હતા લા હતા છે લગે છે હતા છે લા છે તે લગ્ન શાબા છે લા હતા લા પોરા મદર છે લગે ગોર હેદાર) શાખા : શાલિભા છ બ્લાભા છે સાધા (જામીનદાર) શાખા : શાલિભા છ હતા છે હો છે છે લા છે હતા છે લા છે લા છે લા છે લા છે લા ગોર છે લા છે લા છે લા હતા છે લા છે	૨૮ (୨) ની જોગવાઇઓ ટેસથી જણાવવામાં આવે છે કે બ ની થવી સ્કમની વસૂવાવ માટે વ વ ગોઢીવના નામે સ્ઢેલ ટેનામે વ ગોઢીવના નામે સ્ઢેલ ટેનામે ૬ સ્વોર + એમસી મુજબ પહેલો લે ગામ - રખિચાલ, તાલુકો- મિલકતની ચલુ:સીમાં ઉત્તર: વર્ષાત મારે ગ લે ગોઢી સ્ક્રી મગા - રખિચાલ, તાલુકો- મિલકતની ચલુ:સીમાં ઉત્તર: વર્ષાત : શ્રી જગદીશભાઇ ઇશ્વ દેકે ભાગીતી સ્ક્રીમમાં ન વઢેશા કરે ભાગીતી સ્ક્રીમમાં ન વઢેશા છેનલ પ્લો ટનં. ૨૮/૧ (જુનો સ જેલ્લો અમદાવાદ ૧૧ (અસવાલ સ્થિમ : ફ્લેટ નં. રી-૩૦૬, સાંકે દેલાલ અદેસરા ના નામે સ્ટેલ વેલાલ અદેસરા ના નામે સ્ટેલ સ્વાતે ગાયેલ ફી ઢોલ્ડ સેલીડે છે વર્ષ છે અપરાદા - ૧૨ (નિકોલ), ગુ અમદાવાદ - ૧૨ (નિકોલ), ગુ અમદાવાદ - ૧૨ (નિકોલ), ગુ ૮ પશ્ચિમ: હાઉસ નં ૭. સાં કરભારણતી વિ ો તારીખ ઇ-દરાજી એમડીની 1 તારીખ ઇ-દરાજી એમડીની ગ ભેલેન્સ માદોઢ.	મનગર, અમદાવાદ - ૩૮૦૦૫૨ ટેલિ.: (બ દી-મેલ: Zo.ahm ો સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્ચોર્ડ કેડિટર પાકે (ક વેચાણ થશે. રિઝર્વ કિંમત, અર્નેસ્ટ મની ડિપોઝીટ અને ર મિલકત મેન્ટ નં. ૯-બી, પ્લોટ એરિચા ક્ષેત્રફળ અંદાજીત ૮૫ ચં મે માળ ક્ષેત્રફળ અંદાજીત ૧૫૨.૯૬ ચો.મી) એમન્ચુઅલ ક -મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - મણીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સાથીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સાથીનગર, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ - સાથીલ પટેલના નામે સ્ટેલ ફ્લેટ નં.બી/૧૮, ૩૧ે માળ, ાથેલ ફ્લિટ તે સેન્ડવર ગ્ર સ્વો.મી., રેવન્થુ સર્વે નં. ૧૫૪ પૈર ના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (બિકોલ) અને જિલ્લો તોટ ન .૨ પેકી, દક્ષિણ: ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુવ થલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ આ એરિસ્થા પ૧.3 કર્વે નં. પટર/૩), ટાઉન પ્લાનિંગ સ્ક્રીમનો રોડ, પુવ થલ ફ્લેટ નં.સી-૩૦૧, ક્ષેત્રફળ બિલ્ટ આ એરિસા ૫૧.3 કર્લે સ્વર્ક્સ ક્લે બ્લે સ્ક્રિય્ પ્રાયં નં. ૧૪૨, પ્રાશ્વનાથ કેન્સીચલ હાઉસના તમામ ભાગ અને હિસ્શા. મિલકતની આરોટના નામે સ્ટેલ હાઉસ નં. દી-૮૮, પ્લોટ એરિયા લેગ કેતિક કબ્જો વેગતો, જેની બેંકને કંઈ ખબર હોચ- અધિકૃત વ માટે અગલ્યાનો નોધ: બીકરોએ નીચેની ઑપથારિ માટે અગત્થની નોંધ: બીકરોએ નીચેની ઑપથારિ માટે અગત્થના નોધ: બીકરોએ નીચેની ઑપથારિ માટે અગત્થની નોંધ: બીકરોએ નીચેની ઑપથારિ માટે અગત્થની નોંધ: સ્ટતાવેજોને ઈ-હરાજી સર્વિસ ક્	pe) ૨७૪૩૫૬૬૩, edabad@india રીક૦સ્ટ્રક્શન ઓ ગેસ્વે/ચાર્જ રાખેલ છે જે થ્યાવર મિલકતવું ટૂંકમાં નું વિગતવાર વર્ણત ગામેલ્ટ નં.૧૦૨એ, પશ્ચિમ આમદાવાદ- ૭ (ઓટવ) ગામેન્ટ નં.૧૦૨એ, પશ્ચિમ અમદાવાદ, ગુજરાત ૨ : પ્લોટ નં.૧, ટાઉન અમદાવાદ, ગુજરાત ૨ : પ્લોટ નં.૧, રાઉન અમદાવાદ, ગુજરાત ૨ : પ્લોટ નં.૧, પશ્ચિમ લ ચો.મી. તેમજ જમીનન ચો.મી. તેમજ જમીન સ્વારક્સે બાગેલી સ્ક્રીમમાં ગ્રગ્યક ચો.મી. મોજે- કઠ ગામ ભાગ અને હિસ્સા. ર આદ્મકારીની શ્રેષ્ઠતમ કતાઓ વહેલી તકે પૂ bapi/) પર પોતાનો મોવાઇડર દ્વારા વેર્ટ્સ્ક્	, ૨૭૪ ૩૧ ૨૪૮ anbank.co ianbank.co ianbank.co ib સાંકેતિક કબ ii વર્ણન પણ નીચે : ગ સાંકેતિક કબ ii વર્ણન પણ નીચે : ગ સાંકેતિક કબ ii વર્ણને પણ નીચે : ગ સાંકે તે સ્વ માં ટાઉન પ્લાનિંગ માં ટાઉન પ્લોટની વ કે દ્વાડા સીમ, લાલુક ચતુ:સીમાં ઉત્તર માં જાણકારી અને પૂરી કરવાની રહે માં આઇલ નંબ ફાય કરાશે (અંદા	દ, ફેક્સ: (૦૭૯)).in જેસચલ એસેટ્સ ર ભો ઇન્ડિચન બેંક , સિક આપેલ છે. 'સિક્ચોર્ડ અ ગાંધકામ ક્ષેત્રફળ અંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર્ ગાંધકામ ક્ષેત્રફળ ગંદાર ગાંદ, ગુજરાત રાજ્ય ખ -એ. સાંકેતિક કબજો ગાં મુજબ ૧૪.૬૫ ચો.મી ક્ષેત્રે જાગિત્રમાં કારે સ્ક્રીમનો રોડ. સાંકેતિક હિસ્સો ક્ષેત્રફળ ૧૮.૬૦ : કા ક્ષેત્રીલ્મ સાંકેતિક ક્સે સ્વીનમાં ન ગ્રેડ સાંકેતિક કો સ્ટાયે સ્વીનમાં કે સ્વ બેનીનમાં ન ગ્રેડ સાંકે તાં કો સ્ટાયે ક્રે (બ્લોક નં કો સ્ટાયે સ્ટાયે ક્રે (બ્લોક નં કો સ્ટાયે ક્રે (બ્લોક નં કો સાહિતી મુજબ ની સ્ટાયે સ્ટાયે કરે તે (nbank.in, 2. http:	રે હેઝ 3 લે કે કે ડે ટરના અ સે કે કે ડિટરના અ સ્કચામતો છે ડાવ તા ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો ૪૫.૫૧ ચો.મી ઉન પ્લાનિંગ સ્કીગ તો આવેલ સ્થાવ .) તેમજ શિરોમાંથ લ પ્લોટ લાં.૩, મોલ મિલકતના તમામ કબ્ભે થો.મી. ત્રીભે માળ , તાલુકો: દરક્રોઇ દર એમન ગાર્ડન , માધાપર, તાલુક તે : અંદરનો રોડ તું : અંદરનો રોડ ડેસ્ટ્રી ક્ટ અને સવલત ડેસ્ટ્રી અને સવલત ડેસ્ટ્રી અને સવલત ડેસ્ટ્રી કટ અને સવ ડેસ્ટ્રી કટ અને સવલત ડેસ્ટ્રી કટ અને સવલત કેસ્ટ્રી અને સવલત ડેસ્ટ્રી કટ અને સવલત કેસ્ટ્રી ગ્રે લ્યુ ટે સ્ટ્રે દેવરો બી કર સ્ક્રા કેટ અને સવલત કેસ્ટ્રી કટ અને સવલત કેસ્ટ્રી કર અને સવલત કેસ્ટ્રી ગ્રે લ્યુ કે સ્ટ્રે કેસ્ટ્રી ગ્રે લ્યુ કે સ્ટ્રે કેસ્ટ્રી કર અને સવલત કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કર અને સવલત કેસ્ટ્રી કર અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલત કેસ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સવલ કેસ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કે સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કે સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી સ્ટ્રી કે સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી સ્ટ્રી કેસ્ટ અને સ્ટ્રી સ્ટ્રી સ્ટ્રી સ્ટ્રી કેસ્ટ સ્ટ્રી કેસ્ટ સ્ટ્રી સ્ટ સ્ટ્રી સ્ટ્રી સ્ટ્રી સ્ટ્રી સ્ટ સ્ટ્રી સ્ટ્રી સ્ટ સ્ટ્રી સ્ટ સ્ટ્રી સ્ટ સ્ટ્રી સ્ટ સ્ટ સ્ટ્રી સ્ટ	અરાવિત મિલકતોના વે મિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્સ ચિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમછે ઘાની ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે કાયદાના સેક્શન વ સુરક્ષિત ભાકી રકમ . . .<	રાણ માત , ૧૦૦૨ હેઠ બ્લાં છે', '૧ં છે તે કા રાબ-સેક્શન સ્ <mark>ઝ્રવ કિંમત</mark> સ્ડ. 57,92,000/- સ્ડ.12,29,000/- સ્ડ.12,29,000/- સ્ડ.697000/- સ્ડ.31,76,000/- એ) http://ww કેવાચસી વેસ્ટિ	દ (જુઓ રૂલ તાં. જ કળ સ્થાવર મિલકતોના દ સહે' અને 'જે કાંઇ છે તે છે 'ના આદ (૮) તરફ કરજદારનું ધ્યાન દોરવ શરતો અને નિયમોની વધુ વિગત શ્રી દેષક કુમાર, શેક મેને મો.: 9409602726 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી દેવાલાલ ભેરવા, શીફ મેને મો.: 8968370384 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી દેવાલાલ ભેરવા, શીફ મેને મો.: 8968370384 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9458218596 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa શ્રી રાજેશ કુમાર સિંઘ, શીફ મો.: 9833775798 હાં-મેલ : zoahmrecovery@india zoahmedabad@indianbaa	८ (୨)) Aurent Hight II हे नी से आपेत II हे नी से आपेत II Hight Rest Area Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in Narea Inbank.co.in, nk.co.in		

not a round number (i.e., not a multiple of one Equity Share), then the fractional entitlement shall be ignored for computation of entitlement to tender Equity Shares in the Buyback. On account of ignoring the fractional entitlement those Small Shareholders whose entitlement would be zero Equity Shares as on Becord Date will be confirmation and the revised order shall be sent to the custodian again for confirmation.
 d) Upon placing the bid, the Seller Member shall provide a Transaction Registration Slip ('TRS') generated by the

Broker(s) as per secondary market payout mechanism. If such shareholder's bank account details are not available or if the funds transfer instruction is rejected by the Reserve Bank of India ("RBI")/ bank(s), due to

- dispatched a Tender Form with zero entitlement. Such Small Shareholders are entitled to tender additional Equity Shares as part of the Buyback Offer and will be given preference in the acceptance of one Equity Share, if such Small Shareholders have tendered for additional Equity Shares.
- 12.10The Equity Shares tendered as per the entitlement by Eligible Shareholders as well as additional Equity Shares tendered, if any, will be accepted as per the procedures laid down in the SEBI Buyback Regulations.
- 12.11Detailed instructions for participation in the Buyback (Tender of Equity Shares in the Buyback) as well as the relevant time table will be included in the Letter of Offer which will be sent in due course to the Eligible Shareholders as on Record Date and the Company shall comply with the SEBI circular No. SEBI/CIR/CFD/DCR1/CIR/P/2020/83 on "Relaxations relating to procedural matters Takeovers and Buy-back" dated May 14, 2020, read with SEBI Circular No. SEBI/HO/CFD/DCR2/CIR/P/2020/139 dated July 27, 2020, as applicable.

13. PROCESS AND METHODOLOGY TO BE ADOPTED FOR THE BUYBACK

- 13.1 The Buyback is open to all eligible shareholders, i.e., the shareholders who on the Record Date were holding Equity Shares either in physical form ("Physical Shares") and the beneficial owners who on the Record Date were holding Equity Shares in the dematerialized form ("Demat Shares") (such shareholders are referred as the "Eligible Shareholders"). Additionally, the Buyback shall, subject to applicable laws, to be facilitated by tendering of Equity Shares by the shareholders and settlement of the same, through the stock exchange mechanism as specified in the SEBI Circulars.
- 13.2 The Buyback will be implemented using the "Mechanism for acquisition of shares through Stock Exchange" issued by SEBI vide circular no. CIR/CFD/POLICYCELL/1/2015 dated April 13, 2015, circular no. CFD/DCR2/CIR/P/2016/131 dated December 9, 2016 and circular bearing number SEBI/HO/CED/DIL1/CIR/P/2018/011 dated January 19, 2018 and in accordance with the procedure prescribed in the Companies Act and the SEBI Buyback Regulations, and as may be determined by the Board of Directors, or the Buyback Committee (a committee authorised by the Board to exercise its powers in relation to the Buyback, the "Buyback Committee"), on such terms and conditions as may be permitted by law from time to time.
- 13.3 For the implementation of the Buyback, the Company has appointed Systematix Shares and Stocks (India) Limited as the registered broker ("Company's Broker") through whom the purchases and settlements on account of the Buyback would be made by the Company.

The contact details of the Company's Broker are as follows:

Systematix Shares and Stocks (India) Limited

SYSTEMATIX GROUP Investments Re-defined The Capital, A-Wing, No. 603-606, 6th Floor,

Plot No. C-70, G-Block, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai 400 051, India. Telephone: + 91-22-6704 8000 Fax: + 91-22-6704 8029 Email: compliance@systematixgroup.in Contact Person: Mr. Rajkumar Gupta Website : www.systematixgroup.in

- 13.4 The Company will request BSE, being the exclusively designated stock exchange, to provide a separate acquisition window ("Acquisition Window") to facilitate placing of sell orders by Eligible Shareholders who wish to tender Equity Shares in the Buyback. The details of the Acquisition Window will be specified by BSE from time to time. In the event the Stock Broker of any Eligible Shareholder is not registered with BSE as a trading member / stock broker, then that Eligible Shareholder can approach the Company Broker or any other BSE registered stock broker and can register himself by using quick unique client code (UCC) facility through that BSE registered stock broker at submitting all details as may be required by such BSE registered stock broker in compliance with applicable law).
- 13.5 At the beginning of the tendering period, the order for buying Equity Shares will be placed by the Company through Company's Broker.
- 13.6 During the tendering period, the order for selling the Equity Shares will be placed in the Acquisition Window by the Eligible Shareholders through their respective stock brokers ("Shareholder Broker") during normal trading hours of the secondary market. The Shareholder Broker can enter orders for Demat Shares as well as Physical Shares. In the tendering process, the Company's Broker may also process the orders received from the Eligible Shareholders.
- 13.7 The reporting requirements for Non-Resident Shareholders under the Foreign Exchange Management Act, 1999 and any other rules, regulations, guidelines, for remittance of funds, shall be made by the Eligible Shareholder and/or the Shareholder Broker through which the Eligible Shareholder places the bid.
- 13.8 Modification/cancellation of orders and multiple bids from a single Eligible Shareholder will be allowed during the tendering period of the Buyback. Multiple bids made by a single Eligible Shareholder for selling Equity Shares shall be clubbed and considered as "one bid" for the purposes of acceptance.
- 13.9 The cumulative quantity tendered shall be made available on the website of BSE (www.bseindia.com) throughout the trading session and will be updated at specific intervals during the tendering period.

13.10 Procedure to be followed by shareholders holding Demat Shares:

- a) Eligible Shareholders who desire to tender their Equity Shares held by them in dematerialised form under the Buyback would have to do so through their respective Seller Member by indicating the details of Equity Shares they intend to tender under the Buyback, to their Seller Member.
- b) The Seller Member would be required to place an order/bid on behalf of the Eligible Shareholders who wish to tender Equity Shares in the Buyback using the Acquisition Window of BSE. Before placing the order/bid, the Eligible Shareholder would be required to transfer the tendered Equity Shares to the special account of the Indian Clearing Corporation Limited ("Clearing Corporation") by using the early pay-in mechanism as prescribed by BSE and the Clearing Corporation prior to placing the bid by the Seller Member.
- prescribed by BSE and the Clearing Corporation prior to placing the bid by the Seller Member.
 c) The details of the special account of the Clearing Corporation and the settlement number shall be informed in the issue opening circular that will be issued by BSE / Clearing Corporation. For custodian participant orders for dematerialized Equity Shares, early pay-in is mandatory prior to confirmation of order/ bid by custodian participant. The custodian participant shall either confirm or reject the orders no later than the closing of trading hours on the last day of the tendering period. Thereafter, all unconfirmed orders shall be deemed to be rejected. For all confirmed custodian participant orders, order modification shall revoke the custodian

- exchange bidding system to the Eligible Shareholder. The TRS will contain the details of order submitted suc as bid ID number, application number, DP ID, client ID, number of Equity Shares tendered, etc.
- e) The reporting requirements for non-resident shareholders under Reserve Bank of India, Foreign Exchange Management Act, 1999, as amended and any other rules, regulations, guidelines, for remittance of funds, shall be made by the Eligible Shareholders and/ or the Seller Member.
- f) In case of non-receipt of the completed tender form and other documents, but receipt of Equity Shares in the accounts of the Clearing Corporation and a valid bid in the exchange bidding system, the bid by such Equity Shareholder shall be deemed to have been accepted.

13.11 Procedure to be followed by the shareholders holding Physical Shares

- a) In accordance with the SEBI circular no. SEBI/H0/CFD/CMD1/CIR/P/2020/144 dated July 31, 2020; the physical shareholders are allowed to tender their shares in the Buyback. However, such tendering shall be as per the provisions of the SEBI Buyback Regulations.
- b) Eligible Shareholders who are holding physical Equity Shares and intend to participate in the Buyback will be required to approach their respective Shareholder Broker along with the complete set of documents for verification procedures to be carried out before placement of the bid. Such documents will include the (i) Tender Form duly signed by all Eligible Shareholders (in case shares are in joint names, in the same order in which they hold the shares), (ii) original share certificate(s), (iii) valid share transfer form(s)/Form SH-4 duly filled and signed by the transferors (i.e. by all registered Shareholders in same order and as per the specimen signatures registered with the Company) and duly witnessed at the appropriate place authorizing the transfer in favour of the Company, (iv) self-attested copy of PAN Card(s) of all Eligible Shareholders, (v) any other relevant documents such as power of attorney, corporate authorization (including board resolution/specimen signature), notarized copy of death certificate and succession certificate or probated will, if the original shareholder is deceased, etc., as applicable. In addition, if the address of the Eligible Shareholder has undergone a change from the address registered in the register of members of the Company, the Eligible Shareholder would be required to submit a self-attested copy of address prof consisting of any one of the following documents: valid Aadhar card, voter identity card or passport.
- c) Based on these documents, the concerned Shareholder Broker shall place an order/ bid on behalf of the Eligible Shareholders holding Equity Shares in physical form who wish to tender Equity Shares in the Buyback, using the Acquisition Window of BSE. Upon placing the bid, the Shareholder Broker shall provide a TRS generated by the exchange bidding system to the Eligible Shareholder. TRS will contain the details of order submitted like folio no., certificate no., distinctive no., no. of Equity Shares tendered etc.
 d) Any Shareholder Broker/Eligible Shareholder who places a bid for physical Equity Shares, is required to deliver
- d) Any Shareholder Broker/Eligible Shareholder who places a bid for physical Equity Shares, is required to deliver the original share certificate(s) & documents (as mentioned above) along with TRS generated by exchange bidding system upon placing of bid, either by registered post, speed post or courier or hand delivery to the Registrar to the Buyback i.e. Link Intime India Private Limited (at the address mentioned at paragraph 10 below) not later than 2 (two) days from the offer closing date. The envelope should be super scribed as "Asahi Songwon Colors Limited Buyback 2020". One copy of the TRS will be retained by Registrar to the Buyback and it will provide acknowledgement of the same to the Shareholder Broker in case of hand delivery.
- e) The Eligible Shareholders holding physical Equity Shares should note that physical Equity Shares will not be accepted unless the complete set of documents are submitted. Acceptance of the physical Equity Shares for Buyback by the Company shall be subject to verification as per the SEBI Buyback Regulations and any further directions issued in this regard. The Registrar to the Buyback will verify such bids based on the documents submitted on a daily basis and till such verification. BSE shall display such bids as 'unconfirmed physical bids'. Once Registrar to the Buyback confirms the bids, they will be treated as 'confirmed bids'.
- f) In case any Eligible Shareholder has submitted Equity Shares in physical form for dematerialisation, such Eligible Shareholders should ensure that the process of getting the Equity Shares dematerialised is completed well in time so that they can participate in the Buyback before the closure of the tendering period of the Buyback.

13.12 METHOD OF SETTLEMENT

Upon finalization of the basis of acceptance as per SEBI Buyback Regulations:

- a) The Company will transfer the funds pertaining to the Buyback to the Company's Broker bank account, who will transfer the funds pertaining to the Buyback to the Clearing Corporation's bank account as per the prescribed schedule. For Equity Shares accepted under the Buyback, the Equity Shareholders will receive funds pay-out in their bank account from the Clearing Corporation.
- b) The Equity Shares bought back in the demat form would be transferred directly to the escrow account of the Company (the "Demat Escrow Account") provided it is indicated by the Company's Broker or it will be transferred by the Company's Broker to the Demat Escrow Account on receipt of the Equity Shares from the clearing and settlement mechanism of the BSE.
- c) The Eligible Shareholders will have to ensure that they keep the depository participant ("DP") account active and unblocked to receive credit in case of return of Equity Shares, due to rejection or due to non-acceptance.
- d) If the securities transfer instruction is rejected in the depository system, due to any issue then such securities will be transferred to the Shareholder Broker's depository pool account for onward transfer to the Shareholder. Excess Demat Shares or unaccepted Demat Shares, if any, tendered by the Eligible Shareholders would be returned to them by Indian Clearing Corporation Limited ("ICCL"). In case of custodian participant orders, excess Demat Shares or unaccepted Demat Shares, if any, will be returned to the respective custodian participant. Any excess Physical Shares pursuant to proportionate acceptance/rejection will be returned back to the concerned Eligible Shareholders directly by the Registrar to the Buyback. The Company is authorized to split the share certificate and issue new consolidated share certificate for the unaccepted Physical Shares, in case the Physical Shares accepted by the Company are less than the Physical Shares tendered by the shareholder in the Buyback.
- e) In case of certain shareholders viz., NRIs, non-residents etc. (where there are specific regulatory requirements pertaining to funds payout including those prescribed by the RBI) who do not opt to settle through custodians, the funds payout would be given to their respective Shareholder Broker's settlement accounts for releasing the same to such shareholder's account.
- f) The settlements of fund obligation for Demat Shares and Physical Shares shall be affected as per the SEBI circulars and as prescribed by BSE and ICCL from time to time. For Demat Shares accepted under the Buyback, such beneficial owners will receive funds payout in their bank account as provided by the depository system directly to the ICCL and in case of Physical Shares, the ICCL will release the funds to the Shareholder

- any reasons, then the amount payable to the concerned shareholders will be transferred to the Shareholder Broker for onward transfer to such shareholders.
- g) The Shareholder Broker would issue contract note to the Company for the Equity Shares accepted under the Buyback. Company's Broker would also issue a contract note to the Company for the Equity Shares accepted under the Buyback.
- h) Eligible Shareholders who intend to participate in the Buyback should consult their respective Shareholder Broker for any cost, applicable taxes, charges and expenses (including brokerage) that may be levied by the Shareholder Broker upon the selling Eligible Shareholders for tendering Equity Shares in the Buyback (secondary market transaction). The Buyback consideration received by the selling Shareholders, in respect of accepted Equity Shares, could be net of such costs, applicable taxes, charges and expenses (including brokerage) and the Company accepts no responsibility to bear or pay such additional cost, charges and expenses (including brokerage) incurred solely by the selling Eligible Shareholders.
- The Equity Shares bought will be extinguished in the manner and following the procedure prescribed in the Buyback Regulations.

COMPLIANCE OFFICER

Mr. Saji V. Joseph,

14.

Company Secretary

Asahi Songwon Colors Limited "Asahi House", 13, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej-Shilaj Road, Thaltej, Ahmedabad – 380 0059, Gujarat, India, Telephone: +91-79-6832 5000; Fax: +91-79-6832 5099; Email: cs@asahisongwon.com; Website: www.asahisongwon.com

Investors may contact the Compliance Officer for any clarification or to address their grievances, if any, during office hours i.e. 10 AM to 5 PM Indian Standard Time on all working days except Saturday, Sunday and Public holidays.

15. INVESTOR SERVICE CENTRE AND REGISTRAR TO THE BUYBACK

In case of any query, the shareholders may contact to Link Intime India Private Limited, the Registrar and Share Transfer Agent of the Company, appointed as the Investor Service Centre for the purposes of the Buyback, on any day except Saturday and Sunday and public holiday between 9.30 a.m. and 5.30 p.m. at the following address:



Link Intime India Private Limited

C-101, 1st Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West) Mumbai – 400083, Maharashtra, India Telephone: +91 22 4918 6200, Fax: +91-22-4918 6195, Email: asahisongwon.buyback@linkintime.co.in Contact Person: Mr. Sumeet Deshpande SEBI Registration Number: INR000004058 Validity Period: Permanent

16. MANAGER TO THE BUYBACK

The Company has appointed the following as Manager to the Buyback:

	S m	Systematix Corporate Services Limited
Bandra (East), Mumbai 400 051, Maharashtra, India Telephone: +91-22-6704 8022 Fax: +91-22-6704 8022 Email: ecm@systematixgroup.in Website: www.systematixgroup.in Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM000004224	YSTEMATIX GROUP	The Capital, A-Wing, 6th Floor, No. 603-606,
Telephone: +91-22-6704 8022 Fax: +91-22-6704 8022 Email: ecm@systematixgroup.in Website: www.systematixgroup.in Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM000004224	nvestments Re-defined	Plot No. C-70, G-Block, Bandra-Kurla Complex (BKC),
Fax: +91-22-6704 8022 Email: ecm@systematixgroup.in Website: www.systematixgroup.in Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM000004224		Bandra (East), Mumbai 400 051, Maharashtra, India
Email: ecm@systematixgroup.in Website: www.systematixgroup.in Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM 000004224		Telephone: +91-22-6704 8022
Website: www.systematixgroup.in Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM000004224		Fax: +91-22-67048022
Contact Person: Mr. Amit Kumar SEBI Registration Number: INM000004224		Email: ecm@systematixgroup.in
SEBI Registration Number: INM000004224		Website: www.systematixgroup.in
		Contact Person: Mr. Amit Kumar
Validity Period: Permanent		SEBI Registration Number: INM000004224
		Validity Period: Permanent

17. DIRECTORS' RESPONSIBILITY

As per Regulation 24(i)(a) of the Buyback Regulations, the Board accepts responsibility for the information contained in this Public Announcement and for the information contained in all other advertisements, circulars, brochures, publicity materials etc., which may be issued in relation to the Buyback and confirms that the information in such documents contain and will contain true, factual and material information and does not and will not contain any misleading information.

For and on behalf of the Board of Directors of Asahi Songwon Colors Limited

Sd/-	Sd/-	Sd/-
Paru M Jaykrishna	Gokul Mrugesh Jaykrishna	Saji V. Joseph
Chairperson and Managing Director	Joint Managing Director & Chief Executive Officer	Company Secretary
DIN : 00671721	DIN : 00671652	M. No. F9596
Date: November 09, 2020 Place: Ahmedabad.		